

શાશ્વત ગિરિ મહિમા



● રચિયતા ●

શ્રી અધબદાસ કવિ



● સંકલનકાર ●

પરમપૂજ્ય આચાર્ય વિજય નરવાહનસૂરી

પદાર્થ દર્શન ગ્રંથમાળા પુસ્તક-૫૭

શાશ્વત ગિરિ મહિમા

રચયિતા

શ્રી અધ્યભદ્રાસ કવિ

રંકલનકાર

કર્મ સાહિત્ય નિષ્ણાત સિધ્ઘાંત મહોદધિ, સચ્ચારિત્ર યૂગમણિ સ્વ.
આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પદૃધર,
પરમશાસન પ્રભાવક, પરમતારક, સૂરિયક ચક્રવર્તી, સુવિશાળ
ગંગાધિપતિ, ગ્રંદ પૂજ્ય અને ગ્રૌઢ પ્રતિભાના સ્વામી, વ્યાખ્યાન
વાચસ્પતિ, દિક્ષાના દાનવીર સ્વ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય
રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના પહું પ્રભાવક કર્મ સાહિત્યના જ્ઞાતા
પરમ પૂજ્ય આચાર્ય વિજય નરવાહનસ્કૃતિ મહારાજ.

પ્રકાશક

પદાર્થ દર્શન ટ્રસ્ટ

૧૧૮૮, લક્ષ્મીનારાયણાની પોળ,

રાજમહેતાની પોળમાં,

કાળુપુર-અમદાવાદ-૩૮૦૦૦૧.

પુસ્તક-૫૭મુ
શાશ્વત ગિરિ

મહિમા

વીર સં-૨૫૩૧

સને-૨૦૦૫

સંવત-૨૦૬૧

કાગળ સુદ-૧

~~~~~

કિંત

રૂ ૧૨.૦૦

~~~~~

સર્વહક્ક પ્રકાશકને

સ્વાધિન

~~~~~

દાઈપ સેટીંગ

દિલ્લેશ શાહ

~~~~~

મુદ્રક

નવપ્રભાત

પ્રીન્ટિંગ પ્રેસ

ધીકંદા રોડ

અમદાવાદ-૩૮૦૦૦૧

ટે.ન. -૫૨૦૮૬૩૯

~~~~~

## આર્થિક સહયોગ

સુશ્રાવિકા જ્યોતિબેને

જીવનમાં સંવત. ૨૦૬૧

કારતક સુદ ૧૫ થી

મહા સુદ ૮ સુધીમાં

નવ્યાણું ચાગ્રા

શાસ્ત્રવિદ્યિ પ્રમાણે કરેલ

એની અનુમોદનાર્થે.

સુશ્રાવક ઉન્મેશભાઈ

કાન્તિલાલ શાહ

## પ્રાપ્તિ સ્થાનો

### ભરતભાઈ બી.શાહ

૧૦૧/૧૦૨, સરિયા કોમ્પ્લેક્સ, પવિલું એપાર્ટમેન્ટ્સ સામે, સેટ અન્નીયર્સ કોલેજ રોડ, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૮.  
ફોન નં-૨૬૪૬૩૪૩૧-૨૬૪૬૩૪૩૨-૨૬૪૬૩૪૩૩

-----

### નોતમભાઈ આર. વકીલ (ચાર્ટર્ડ એક્ઝાઇનિટ)

૧૬, ન્યુ આશિષ ફ્લેટ્સ, શેફલ્સ સેન્ટરની સામે, એલીસબીજ, અમદાવાદ-૩૮૦૦૦૩.  
ફોન નં : ૨૬૪૭૮૮૮૩ મોબાઇલ નં - ૨૧૯૪૬૨૬, ૯૮૨૪૧૫૬૬૧૩.  
ઈમેલ - nautam@nautam vakil.Com.  
વેબસાઈટ - www.nautam vakil.Com.

-----

### અશ્વિનભાઈ એસ.શાહ

C/O નગીનદાસ છવનલાલ ઠે. પાંચિકુંબ દરવાજા ખાડાર અમદાવાદ-૩૮૦૦૦૨. ફોન: ૨૨૧૪૪૧૧૨૧

-----

### યંત્રેશભાઈ રસીકલાલ દોશી

૫/૧૨, દામુભાઈ કોલોનેની જ્વાહરનગર, વાસણી, અમદાવાદ-૩૮૦૦૦૦૭. ફોન: ૨૬૬૩૨૮૬૦

-----

### હિંમતભાઈ બી. શાહ

૨, યેતન સોસાયટી, અકોટા રોડ, વડોદરા-૩૯૦૦૨૦. ફોન: ૨૩૧૦૩૪૩, ૨૩૨૨૮૬૨

-----

### ડૉ હસમુખભાઈ આર. શાહ

બી-૩, વિનીત, મજદૂરીયાનગર, એસ.વી.રોડ, કાંદીવલી (વેસ્ટ), મુંબઈ નં-૪૦૦૦૬૭.  
ફોન નં-૨૮૦૭૦૪૬, ૨૮૦૫૨૩૭૫, ૨૮૬૨૨૪૬

-----

### પણાબેન ચંદ્રકાંતભાઈ કાપડીયા

૭/૭ ચંદ્રકાંતભાઈ કાપડીયા ત૩૦૧, મીલેંપર ટાપ્ય, મહાનગરાંબી રોડ, પાંચ રસ્તા, મુંબઈ (વેસ્ટ) મુંબઈ નં-૪૦૦૦૮૦.  
ફોન નં-૪૨-૨૪૬૮૭૭૬૬, ૨૪૬૧૩૬૭.  
મોબાઇલ - ૯૮૨૨૧૧૦૮૮૨ (ચંદ્રકાંતભાઈ) ● ડૉ. ગોવિ - ૯૮૨૨૧૩૨૨૧૦

-----

### મહેશભાઈ ભુરાતાલ પરીખ

૩૦૩, શ્રી સાંક્ષાળા એપાર્ટમેન્ટ, બાવન જિનાલયની પાછળા, ૬૦ ફૂટ રોડ, ભાયંદર (વેસ્ટ)-૪૦૧૧૦૧. ડી-થાણ.  
ફોન નં-૨૪૧૫૩૦૬૨

-----

### આશીતભાઈ વી. ચોકસી

૧/૨૦૯, રામનગર-પાટકર કોલેજ સામે, એસ.વી.રોડ, ગોરેગંગ (વેસ્ટ), મુંબઈ નં-૪૦૦૦૬૨.  
ફોન નં-૨૪૩૨૩૪૩૨ મોબાઇલ નં-૯૮૨૧૧-૧૩૬૪૫



-: શાશ્વત ગિરિ મહિમા :-

શાશ્વત ગિરિ  
મહિમા

એક દિવસ શ્રી હેમસૂરિ મહારાજ કુમારપાળ ભૂપાળ  
અને સકળ સભાસમક્ષ ભવ્યજીવને હિતકારી અમૃતસમ  
અલિઓપકારી મધુર દેશના આપતા હતા અને શાંત ચિત્તથી  
સર્વ શ્રોતાઓ પવિત્ર રસનું પાન કરતા હતા જેમાં સૂરિ  
મહારાજાએ જણાવ્યું કે- “જો પૂર્વની પુન્યાદ્ય હોય અને

:- શાક્ષત ગિરિ મહિમા :-

સુકૃતની કમાઈ હોય તો પ્રાણી “સોળ સસા” મેળવી શકે છે. એટલે કે જે શાદની આદિમાં “સ” આવે એવા સોળ કાર્ય સુપુન્યે સેવી શકે છે.” તે “સોળ સસા” રા પ્રમાણે છે :-

૧. સદગુર સેવા, ૨. સુકૃતે જન્મ, ૩. સંઘભક્તિ, ૪. સદહણા, ૫. ધર્મસુદ્રવ્ય, ૬. સુકૃતકરી યાત્રા, ૭. પુન્યે લહીએ મુનિ સુપાત્ર, ૮. સાતક્ષેપ તણું પોષવું, ૯. સત્ય વચન મુખથી ભાખવું, ૧૦. સમતા કુંડમાંછે ઝીલવું, ૧૧. જેહને શુભગતિ વહેલું જવું, ૧૨. સમાધિ શરીર, ૧૩. સિદ્ધાંત સમ્યક્, ૧૪. શીલ રાખે એકાંત, ૧૫. સાહસિક ગુણ તે પુન્યે પમાય, ૧૬. પુન્યે સંઘપતિ તિલક ધરાય. “સોળ-સસા” એમ વિવરી કહ્યા, પૂર્વ પુન્ય તેણે નર લખ્યા.

આ “સોળ-સસા” માં “પુન્યે સંઘપતિ તિલક ધરાય” એ ઉપર વિવેચન કરતાં સૂરિશ્રી હેમસૂરિ મહારાજાએ જણાવું કે- “સંઘવીપદ પ્રાપ્ત કરવું એટલે સંઘ કાઢી યાગ્રાનો અપૂર્વ છાવો લઇ સંઘવીનું તિલક ધારણ કરવું એ મહાન પુન્યનું કાર્ય છે અને આત્માને અવશ્ય ઉત્તમગતિ આપનારં છે.”

સંઘ કાઢીને યાગ્રા કરવાથી અનેક ભવ્ય જીવોને યાગ્રાનો અપૂર્વ લાભ મળે છે, પ્રત-તપ-જપ-નિયમાદિ ધાર્મિક

-ઃ શાશ્વત ગિરિ મહિમા :-

કરણીની પુષ્ટિ થાય છે, મળેલ લક્ષ્મીનો સદ્વ્યય થાય છે, શાસનની શોભા વધે છે, જૈનેતરો પણ જૈનધર્મની અનુમોદના કરે છે અને પોતાનો આત્મા અલ્પસંસારી બજી મુક્તિપુરીમાં પહોંચી જાય છે. કહ્યું છે કે- “શ્રાવક સમુદાયમાં પ્રતિધારી શ્રાવક વડીલ તરીકે માન્ય કરવા યોગ્ય છે; પરંતુ તે પ્રતિધારી શ્રાવકથી પંચમહાપ્રતિધારી મુનિરાજ શ્રેષ્ઠ ગણાય છે, અને તે મુનિરાજથી આચાર્ય મહારાજ શ્રેષ્ઠ ગણાય છે કે જેમના પગમાં પડી મુનિવરો નમસ્કાર કરે છે. તે આચાર્ય મહારાજથી અર્થિંત ભગવાન શ્રેષ્ઠ ગણાય છે કે જેમનું ધ્યાન અહોનિશ આચાર્યો કર્યાજ કરે છે; પરંતુ તે અર્થિંત ભગવાન પણ સિદ્ધ ભગવાનને નમસ્કાર કરે છે. એવા સિદ્ધ ભગવંતને જે પુરુષ સંઘવીપદ પ્રાપ્ત કરી તીર્થયાત્રાનો મહાન લાભ મેળવે છે તેના ગુણ હમેશાં બહુ જ ગમે છે, તેથી ટુંકામાં કહીએ તો જો પુન્યની રાશી એકઠી થઇ હોય તો જ સંઘ કાટી સિદ્ધાચળની યાત્રાનો મહાન् છ્વાવો લઈ શકાય છે; કેમકે અન્ય તીર્થની છ મહિના પર્યુપાસના કરીને જે કાર્ય સાધી શકાય અને જે લાભ મેળવી શકાય તે લાભ ક્ષણ માત્રમાં પરિણામની વિશુદ્ધતાથી શ્રી સિદ્ધગિરિની છાયામાં ધ્યાન ધરતાં મેળવી શકાય છે.

-: શાશ્વત ગિરિ મહિમા :-

શ્રી હેમસૂર્તિ મહારાજ કુમારપાળ ભૂપાળ અને સકળ સભાસમક્ષ શ્રી સિદ્ગાચયળનું અપૂર્વ માહાત્મ્ય વિસ્તારથી જણાવતાં કહેવા લાગ્યા કે- “શ્રી નંદીશ્વરદ્વીપની યાત્રા કરતાં પ્રાણી જે પુન્ય ઉપાર્જન કરે છે તેથી બમણું કુંડળદ્વીપની યાત્રાથી, અણગણું રચકદ્વીપની યાત્રાથી, ચારગણું ગજદંતગિરિની યાત્રાથી, પાંચગણું જંબૂવૃક્ષ પરના ધૈત્યની યાત્રાથી, છ ગણું ધાતકીખંડની યાત્રાથી, બાવીશગણું પુષ્કરવરદ્વીપની યાત્રાથી, સોગણું મેરના ધૈત્યની યાત્રાથી, છલજરગણું સમેતશિખરની યાત્રાથી, લાખગણું કંચનગિરિની યાત્રાથી, દશ લાખગણું શ્રી અષ્ટપદ તીર્થ અને નગિરનારની યાત્રાથી ક્રોડગણું ફળ શ્રી શાંત્રિજ્ય તીર્થની યાત્રાથી થાય છે. (કેટલાગણું પુણ્ય એમાં કેટલાક સ્તવનાદિમાં ફેરફાર છે. કેટલાગણું કહેવામાં કેટલોક આધાર છે પરંતુ ખરી રીતે તો ભાવની વૃદ્ધિ અનુસાર ફળપ્રાસિ થાય છે. આ તો વ્યવહારિક મધ્યમ ફળ માત્ર કહેલું છે.) શ્રી શાંત્રિજ્ય તીર્થ સર્વ તીર્થોમાં શ્રેષ્ઠ છે અને એ પરમ પુનિત, પરમ ઉપગારી, પરમ કલ્યાણકારી અને શાંતિનિકેતન તીર્થ પ્રાયે કરીને (પ્રાયે શાણ પર્વતનું પ્રમાણ નાનું મોટું થાય છે તેથી વાપરેલ છે.) શાશ્વતું છે. જગતની પ્રવૃત્તિમાંથી અને ધમાલમાંથી

મુકૃત થઇ શ્રી સિદ્ગાચળગિરિની છાયામાં જનારા પ્રાણીને  
આત્માની અંદર અપૂર્વ શાંતિ અને અખંડ લહેરીઓ દેનારં  
એ ધામ છે.”

રાસકર્તા કવિ અધ્યભદાસે શ્રી સિદ્ગિરિનું ઉત્તમ  
અને ભાવવાહી એક સ્તવન આ સ્થળે લખેલ છે, તે ખાસ  
ગાવા લાયક, સાંભળવા લાયક અને કંદસ્થ કરવા લાયક  
હોવાથી આ નીચે આપ્યું છે.

### **શ્રી સિદ્ગાચળનું સ્તવન**

‘ દેશી-( રામ ભણે હરિ ઉઠિયો )

અથવા

( સહેજાનંદી રે આત્મા.)

શોશ્રૂંજો સેવો રે ભવિજના. ( ૨ ) એ આંકણી.

જગમાં તીરથ છે ઘણા, તેહમાં શોશ્રૂંજો સાર રે,

પામ્યા ભવિજન પાર રે, વારે તે ગતિ ચાર રે;

પોત્યા મોક્ષ દુવાર રે- શોશ્રૂંજો

જે નર “છ-રી” રે પાળતાં, શોશ્રૂંજો વંદન જાય રે,

નદી શોશ્રૂંજુમાં નહાય રે, પોટાં પાપ ધોવાય રે;

એમ ઘટ નિર્મળ થાય રે- શોશ્રૂંજો

-ઃ શાશ્વત ગ્રાન્તિ મહિમા :-

સમકિત શિયળને રાખતો, પગે ચાલંતો જે જાય રે,  
અએકલાહારી કહેવાય રે, ભૂમિસંથારે તે ઠાય રે;

સચિતપરિહારી સોહાય રે- શેશ્રુંજોં

શેશ્રુંજો વધાવા કારણે, હોલો અતિ ઉજમાળ રે,  
દેછ પ્રદક્ષિણા લાલ રે, કર્મ ખપાવે તતકાળ રે;

પ્રગટે પુન્ય વિશાળ રે- શેશ્રુંજોં

સૂરજકુંડ ને ભીમમાં, નહાતાં નિર્મિણ નીર રે,  
નહિ તસરોગ શરીર રે, જસ ગુણ અતિહિ ગંભીર રે;

ભાખે આદિ ને વીર રે- શેશ્રુંજોં

પશુ પંખ્યાદિ જે જુવડા, જલચર જંતુ વળી જેહ રે,  
સેવે શેશ્રુંજો તેહ રે, દુઃખીઆ નહિ તસ દેહ રે;

ત્રીજે ભવ સિદ્ધ સ્નેહ રે- શેશ્રુંજોં

સાત છછુ દોઇ અહુમે, ગણે વળી લાખ નવકાર રે,  
સેવે શેશ્રુંજો સાર રે, તેહને દો અવતાર રે;

તે નિશ્ચે અવધાર રે- શેશ્રુંજોં

પંચ ભરત મહાવિદેહમાં, અરાવત પંચ જોય રે,  
તીર્થ દ્યશ્યો નહિ કોય રે, ભરત પેખંતા સોય રે;

દીકે ગ્રિભુવન મ્હોય રે- શેશ્રુંજોં

શ્રી શશ્રુંજ્ય તીર્થના અપૂર્વ મહિમાનું વર્ણન આગાળ

-: શાશ્વત ગિરિ મહિમા :-

યલાવતાં હેમસૂરિ મહારાજ બોલ્યા કે- “પરમપવિત્ર શ્રી સિદ્ગિદિની યાગ્રા મહાન સંઘ કાઢીને ધણા ભાગ્યશાળીઓએ મોટા ખર્ચે કરીને કરી છે, સંઘપતિપણાનો અપૂર્વ લાભ મેળવ્યો છે તથા એ તીર્થનો ઉદ્ઘાર કરાવી અચળ નામના મેળવી છે. જેનું વર્ણન સંક્ષેપમાં આ પ્રમાણે છે.

શ્રી અધ્યભદેવ ભગવંતની દેશના સાંભળી ભરત મહારાજાએ મહાન સંઘ કાઢી શ્રી સિદ્ગાચળની યાગ્રાનો અપૂર્વ લાભ પ્રાપ્ત કરેલ છે, જે સંઘમાં નવાણુ કરોડ તો સંઘવીઓ સાથે હતા એટલે જેમણે સંઘ કાઢી સંઘવીપદ પ્રાપ્ત કરેલ એવાં નવાણુ કરોડ શ્રેષ્ઠીજનો સાથે હતા તેમજ ચોરાશી હજાર નૃપતિઓ પણ સંઘમાં સાથે હતા. એવી રીતે સંપૂર્ણ અદ્ભુ-સિદ્ગિ સાથે અને મોટી સંખ્યામાં યાગ્રાળુઓ સહિત ધણી જ ધામદ્યુમથી ભરત મહારાજાએ સંઘ કાઢી શ્રી સિદ્ગાચળ તીર્થનો પ્રથમ ઉદ્ઘાર કરાવેલ છે.

તે ભરત ભૂપતિની પાટે અનુકૂમે આદિત્યયશા, મહાયશા, અતિબલ, બલભદ્ર, બલવીર્ય, કીર્તિવીર્ય અને જલવીર્ય ભૂપતિઓ થાઈ ગયા, તેમની અને ભરત મહારાજાની વરચ્છે છ કરોડ પૂર્વ વ્યતીત થયા બાદ આઠમી

- : શાશ્વત ગિરિ અહિમા :-

પાટે દંડવીર્ય ભૂપતિ થયા. તેમણે ભરત મહારાજાની પેઢે સંઘ કાઢી શ્રી શાંતુજ્ય તીર્થનો બીજો ઉદ્ધાર કરાવેલ છે.

તત્પશ્ચાત શ્રી શાંતુજ્ય તીર્થનો બીજો ઉદ્ધાર ઈશાનેંદ્રે, ચોથો ઉદ્ધાર માહેંદ્રે, પાંચમો ઉદ્ધાર બ્રહ્મદ્રે, છઠો ઉદ્ધાર ચમદેંદ્રે અને સાતમો ઉદ્ધાર સગર ચક્રવર્તીએ કરાવેલ છે. તે સગર ચક્રવર્તીના સમયે પચાસ કરોડ, પંચાણુ લાખ, પંચોતેર હજાર ભૂપતિઓએ શ્રી સિદ્ધગિરિનો સંઘ કાઢી સંધીપદ પ્રાક્ત કરેલ છે અને તેમણે રત્નમય અને કનકમય જિનબિંબો કરાવી મહાન લાભ પ્રાક્ત કરેન છે

ત્યારબાદ આઠમો ઉદ્ધાર વ્યંતરેંદ્રે, નવમો ઉદ્ધાર ચંદ્રયશા રાજાએ, દશમો ઉદ્ધાર ચક્રાયુદ્ધ રાજાએ, અગીયારમો ઉદ્ધાર રામચંદ્રજીએ અને બારમો ઉદ્ધાર પાંચ પાંડવોએ કરાવેલ છે. પાંચ પાંડવ અને શ્રી વીર ભગવાન વચ્ચેનું ચોરાશી હજાર વર્ષોનું અંતર વીત્યા બાદ વીર પણી ૪૭૦ વર્ષે શ્રી વિક્રમ રાજા થયા, જેમનો સંવત લખાવો શરૂ થયો. તે સંવત એકસો ને આઠમાં જાવડશાહ શેડે આ તીર્થનો તેરમો ઉદ્ધાર કરાવેલ છે. બારમો ઉદ્ધાર કરાવનાર પાંચ પાંડવ અને તેરમો ઉદ્ધાર કરાવનાર જાવડશાહની વચ્ચેના સમયમાં પચીશ કોડ, પંચાણું લાખ, પંચોતેર હજાર

-: શાખત ગિરી મહિમા :-

ભૂપતિઓએ સંઘવીપદ પ્રાપ્ત કરી મહાન् સંઘ કાઢીને શ્રી સિદ્ગાચળને ભેટી અપૂર્વ લ્હાવો લીધેલ છે. વિજ્ઞમ સંવત બારશેં ચઉદની (અહીં સંવત ૧૨૧૧ કહી આવેલ છે. નવાણુપ્રકારી પૂજામાં સં. ૧૨૧૩ કહેલ છે.) સાલમાં મંત્રી આહડે ચૌદમો ઉદ્ધાર કરાવેલ છે. સંવત તેરશેં ઈકોતેરમાં ઓશવાળવંશદીપક સમરાશાહે પંદરમો ઉદ્ધાર કરાવેલ છે અને સંવત પંદરશેં સત્યાશીમાં શોઠ કરમાશાહે શ્રી સિદ્ગગિરિનો સોળમો ઉદ્ધાર કરાવ્યો છે. (હેમચંદ્રાચાર્ય થઇ ગયા પછીની આ હકીકત અષ્ટભદાસની કહેલી છે એમ સમજવું.)

સંવત બારશેં વ્યાસીમાં મંત્રી વસ્તુપાળ-તેજપાળ શ્રી સિદ્ગાચળનો મહાન સંઘ કાઢી સંઘવીપદ પ્રાપ્ત કરી જન્મ સફળ કરેલ છે. તેમણે નવીન અને ભવ્ય જિનમંદિર શાંતુંજય ઉપર કરાવેલ છે ને એકંદર અઠાર કોડ, ઓગણપચાસ લાખ સુવર્ણ ટકા ખર્ચી અપૂર્વ લાભ લીધેલ છે, તેમજ શ્રી અર્બુદાચળ અને ગિરનારની યાત્રા કરી એકાશી કોડ અને બત્રીશ લાખ સુવર્ણ ટકા ખરચ્યા છે અને જેમણે સવાલાખ જિનબિંબો ભરાવ્યા છે. આવી ઉત્તમ તીર્થભક્તિ કરનાર તે બજે પુન્યશાળી બન્ધુઓના નામ અદ્યાપિ પણ જગતમાં

:- શાશ્વત ગિરિ મહિમા :-

મશાહુર છે.

શેઠ જાવડશાહ અને શેઠ કર્મશાહ કે જેમણે અનુકૂમે તેરમો અને સોળમો ઉદ્વાર શ્રી સિદ્ધાચળ તીર્થનો કરાવેલ છે. તે બજેની વર્ષેના સમયમાં ચોરાશી લાખ સંઘંવીઓ પ્રણ લાખ સમકૃતિધારી ભૂપતિઓ, સતર હજાર ભાવસારો, સોળ હજાર ખત્રીઓ, પંદર હજાર વિપ્રો, બાર હજાર કણાબીઓ, નવ હજાર લેઉઆ કણાબીઓ અને પાંચ હજાર પીસ્તાલીશ કંસારાઓ-એ સર્વેએ શ્રી વિમલાચળ તીર્થના સંધો કાઢીને મહાન્ય લાખ મેળવેલ છે. શ્રી ભરત મહારાજ કે જેમણે આ તીર્થનો પ્રથમ ઉદ્વાર કરાવેલ છે તે અને છેલ્લો એટલે સોળમો ઉદ્વાર કરાવનાર શેઠ કરમાશાહની વર્ષેના સમયમાં શ્રી સિદ્ધગિરિના જે જે સંધો નીકળ્યા છે તેની સંખ્યા તો કેવળીગમ્ય સમજવી.

અહિં રાસકર્તા કવિ અધ્યભદાસ કહે છે કે :-

જે પુન્યવંતા નરવળી હોવે, તે શામુંજય ગિરિવર જોવે;  
પુન્ય ઠામે ધન ખરચ્યું જેણો, સોય સંઘાતે આવે તેને.

તે પુન્યવંતા નર વળી હોંશો, કરશે શેમુંજાની જાત્ર;  
તે નર રાને રોચા જાણો, જેણો ન કીધી તેની ચાત્ર.

-: શાક્ષત ગિરિ મહિમા :-

દીન ઉદ્વાર ન કીધો જેણે, ન લછો શાસ્ત્રવિચાર; ગિરિ શેખુંજે કે નવી ચટિયો, એળે ગયો તસ અવતાર.

જન્મ સફળ કીધો નર જેણે, લક્ષ્મી સુમાર્ગ સ્થાપી; શેખુંજે જૈ પ્રાસાદ કરાવ્યા, તસ કીર્તિ જગ વ્યાપી.

મુગતિતણે પંથે વળયા, પામી કેવળજાન; સિદ્ધ અનંત આગે હુઆ, કરતા શાત્રુંજય દ્વાન.

હે રાજ કુમારપાળ ! જેણે શ્રી શાત્રુંજય તીર્થની ચાંપા કરી લક્ષ્મીનો સદ્વ્યાય કરેલ છે તેણે પોતાનો જન્મ સફળ કરી લીધો છે. એ પવિત્ર તીર્થના દર્શનથી કર્મના દળીયાં ટુટી જાય છે, વંદનથી નરક અને તિર્યચાગતિનાં દુઃખોનું નિવારણ થઈ જાય છે, સ્તવન અને પૂજનથી આત્મા નિર્મળ બની પરમ સુખનો અધિકારી થાય છે અને સંઘપતિ થવાથી તીર્થકરની પદવી પમાય છે. શ્રી સિદ્ધગિરિનું દ્વાન ધરીને અનંતા ભવ્યજીવો સિદ્ધિપદને પામ્યા છે તેની છકીકત આ નીચે જણાવી છે તે વાંચી શ્રી સિદ્ધાચળનો અપૂર્વ મહિમા સમજુ. તીર્થચાંપા કરી આત્મકત્વાણ સાધી લેવું એ પુનઃપુનઃ કુથન છે.

શ્રી શાત્રુંજય ઉપર ચૈત્ર શુદ્ધ ૧૫ મે પ્રથમ પ્રભુના

ગાળાધર પુંડરીકસ્યામી પાંચ કોડ મુનિ સાથે સિદ્ધિપ્રદને પામ્યા છે. કાર્તિક સુદિ ૧૫ મે દ્રાવિદ અને વારિખીલ દશ કોડ મુનિ સાથે સિદ્ધિપ્રદને પામ્યા છે. ફાગણ સુદિ ૧૦ મે નમિ-વિનમિ બે કોડ મુનિસાથે સિદ્ધિપ્રદ પામ્યા છે. શ્રી અષ્ટભદેવની પાટે અસંખ્યાતા મુનિઓ સિદ્ધિએ ને સર્વાર્થ સિદ્ધે ગયા છે તે પણ આ તીર્થીથી ગયા છે. અષ્ટભદેવના વંશના અસંખ્ય રાજાઓ ચારિત્ર લઇ શરૂંજય આવી અણસણ કરી સિદ્ધિપ્રદ પામ્યા છે. રામ ને ભરત (આ રામ, ભરત દશરથપુત્ર નથી, બીજા સંભવે છે.) બે બાંધવ ત્રણ કોડ મુનિ સાથે સિદ્ધિપ્રદ પામ્યા છે. શ્રી કૃષ્ણના પુત્ર શાંબ ને પ્રધુમ્ન સાડીઆઠ કોડ મુનિ સાથે ફાળ્યુન સુદિ ૧૩ શે અહીં સિદ્ધિપ્રદને પામ્યા છે. પાંચ પાંડવો વીશ કોડ મુનિ સાથે અહીં પદારી મોક્ષમાર્ગ સીધાવ્યા છે. થાવચ્ચાપુત્ર મુનિ એક હબાર સાથે, શુકૃપરિવ્રાજક એક હબાર મુનિ સાથે, સેલગ સૂર્તિ પાંચશેં મુનિ સાથે સિદ્ધિપ્રદને પામ્યા છે. નારદ મુનિ (નવમાંથી કચા નારદ એ સ્પષ્ટ કહેલ નથી.) એકાણું લાખ સાથે આ તીર્થ મોક્ષમાર્ગ સંચર્યા છે. એમ સંખ્યાબંધ મુનિઓ સાથે અનેક મહાત્માઓ આ તીર્થના અવલંબને મોક્ષમાર્ગના સાધનારા થયા છે. શ્રી અષ્ટભ્રત

- : શાશ્વત ગિરિ મહિમા :-

નવાળું પૂર્વ (૮૪ લાખને ૮૪ લાખે ગુણતાં એક પૂર્વ તેને ૮૮ વડે ગુણતાં જે અંક આંદે તેટલી વખત પદ્ધાર્યો.) વખત પ્રાચે ફાળુન સુછિ ૮ મે આ તીર્થ પર સમવસર્યા છે. અભિતનાથ અને શાંતિનાથ પરમાત્મા આ તીર્થે ચાતુર્મસ રહ્યા હતા તે વખતે અનેક મુનિઓ સિદ્ધિપેદને પામ્યા છે.

શ્રી હેમસૂર્ચિ મહારાજ પાસેથી પવિત્ર તીર્થ શ્રી સિદ્ધાચળનો અપૂર્વ મહિમા સાંભળીને કુમારપાળ ભૂપાળનું હૃદય એકદમ ઉલ્લસિત થતાં શ્રી સિદ્ધગિરિનો સંઘ કાઢી લક્ષ્મીનો સદ્વ્યય કરી માનવદેહની સાર્થકતા કરવાની અભિલાષા જાગ્રત થઇ અને વ્યાખ્યાન સંપૂર્ણ થયા બાદ પોતાને થયેલી ભાવના ગુરુ સમક્ષ પ્રગટ કરી તુરત જ તૈયારી કરવા માંડી.

પ્રથમ તો શ્રી હેમસૂર્ચિ મહારાજને સકળ સાધુપરિવાર સહિત સંઘમાં પદારવાની વિનંતિ કુમારપાળ મહારાજે વિનયપૂર્વક કરી અને નગરમાંથી જે કોઇને આવવું હોય તેને તમામ પ્રકારની સગવડતાથી યાત્રાનો મહાન લાભ મળી શકશે તેવી જાહેર ઉદ્ઘોષણા કરાવી. શુભ મુહૂર્તે શ્રી સિદ્ધાચળની યાત્રા કરવાનો મહાન સંઘ કાઢ્યો.

કુમારપાળ ભૂપાળે કાટેલા સંઘની હકીકત ખાસ

:- શાશ્વત ગિરિ મહિમા :-

લાગવા લાયક અને અનુમોદવા લાયક છે. સંઘમાં હસ્તીઓની અંબાડીમાં શ્રી જિનેશ્વર ભગવાનની મૂર્તિસહ સુશોભિત જિનમંદિરો શોભતા હતા, વાગ્ભવ્ષાદિ ચોવીશ નિપુણ મંત્રીઓ સાથે હતા, નગરશેઠના પુત્ર આભડે શેઠ સાથે હતા કે જે ચર્સ્તામાં જ્યાં જ્યાં પડાવ થતો હતો ત્યાં ત્યાં શ્રાવકના ઘરદીઠ સોવન-ટકાની લ્હાણી પોતાના તરફથી કરાવી સાધભીજવાત્સલ્યનો લાભ લેતા હતા, પઢભાષાચક્વર્તી દેપાળ કવિ પણ સાથે હતા, કપર્દી ભંડારી સાથે હતા કે જેમની ઉદારવૃત્તિ અને દયાની નજરથી કોઇ પણ માણસ ભૂખ્યો કે દુઃખી રહેતો જ નહિ, પાલણપુરનો પ્રહલાદ રાણી, નવાણુ લાખની પુંજુવાળા છાડાશેઠ, રાજાના ભાણેજ પ્રતાપમલ્ય, અન્ય શેઠ-શાહુકારો, સર્વ દર્શનવાળા ધર્મગુરુઓ અને સદ્ગૃહસ્થો, શ્રી હેમસૂરીશ્વર મહારાજ આદિ મુનિમંડળ અને સંખ્યાબંધ ચાત્રાળુસહિત એ સંઘ શોભતો હતો.

એ સંઘમાં અગીયાર હજાર હસ્તીઓ રલ્નજડિત અંબાડીઓથી દીપતા હતા અને સાચા મોતીની માળાઓથી ગૂલતા હતા, અગીઆર લાખ પંચવર્ણી અશ્વો શોભતા હતા, અદાર લાખ પાચદળ-પગો ચાલનારા સૈનિકો હતા, પચાસ હજાર રથ હતા જેના બંળદો ધુઘરમાળનો ધમકાર કરી

મધુર અવાજ આપતા હતા અને સુવર્ણના શીંગડાઓથી તેજસ્વી લાગતા હતા, તેમજ ટોલ, દદામા, ભેરી, નક્કેરી, સરણાઈ ઇત્યાદિ વાજુંગ્રો નિરંતર વાગતા હતા. ગ્રંથેરીઓ, નાણાવટી, સોનીવાણીયા, દોશીવાણીયા, ફોકલીયા, વણજ્ઞારા, પૈધો અને ગાંધી એવા એવા અનેક દંધાધારીઓ પણ સંઘમાં આવ્યા હતા અને સંઘમાં મનુષ્યો મોટી સંખ્યામાં હોવાથી સૌનો દંધો પણ સારી રીતે ચાલતો હતો. સંઘના કામકાજ માટે માળી, તંબોલી, ભોઇ, કંદોઇ, કંસારા, મહીયાર, સોનાર, સુતાર, લુહાર, કુંભાર, નાવી, ગોલા, દરજી, જડીયા, કણબી, રસોઇયા, પાણી ભરનારા, મર્દનીયા, કાવડીયા, ચીતારા, છીપા અને ગાંધર્વો વિગેરે મોટી સંખ્યામાં સાથે રાખેલા હતા.

શ્રી સંઘમાં પતિસેવાપરાયણ, શિયળ ગુણે કરીને સુશોભિત પહુંરાણી ભોપલદેવી (ભોપલદેવી સંઘ કાટ્યા પછી ગુજરી ગયેલ જણાય છે.) પણ સાથે હતા, જેમની સાથે બોંતેર સામંત રાજાઓની રાણીઓ અલંકારયુક્ત વિદ્યવિદ્ય રંગબેરંગી ઉત્તમ વસ્ત્રોથી શોભતી હતી, અને અન્ય શોઠ-શાહુકારોની ઋતીઓ પણ સાથે હતી. સર્વ સંઘભક્તિ યથાશક્તિ કરતા હતા અને માંહોમાંહે વાર્તાલાપ

- : શાક્ત ગીત મહિમા :-

કરી આનંદમાં સમય પસાર કરતા હતા. પરસ્પર હાસ્ય-વિનોદની ખાતર મશકરી મજાહ પણ થતી હતી.

જે સ્ત્રીઓનું રૂપ ઉજવળ એટલે શ્વેત હતું તે સ્ત્રીઓ શ્યામવર્ણી-કાળી સ્ત્રીઓ પ્રત્યે કહેવા લાગી કે- “બહેનો ! અમે ઉજવળતાએ એટલે ગોરા વાને કરીને સુંદર રીતે શોભીએ છીએ, તેમાં અમારી સાથે તમે શ્યામ-કાળી સ્ત્રીઓ અમારી પંક્તિમાં બીલકુલ ભળતી જ નથી. તમારા શરીરના વર્ણની ભાત જુદી જ પડી જાય છે એટલે એકંદરે અમારી સુંદરતા ઓછી થઈ જાય છે, તેથી અમે તો કહીએ છીએ કે કાળાશ-શ્યામતા જગતમાં કોઇ પણ રીતે દર્શાવા લાયક જ નથી.”

તેના જવાબમાં જે કાળી સ્ત્રીઓ હતી તે કહેવા લાગી કે- “બહેનો ! સાંભળો, ભલે કાળાપણું તમારી દ્રાષ્ટિમાં ઢીક લાગતું નહિ હોય પરંતુ હસ્તીઓ પણ કાળ હોય છે કે જે મદોભૂત થઈને ફરતા ફરે છે, મેઘરાખ જે સહુના માથે ગાજ્યા કરે છે તે પણ શ્યામ છે, આંખની કીકી કાળી છે અને આંખ આંજવામાં આંજણની જરૂર પડે છે તે પણ કાળું છે, જમુના નદીના જળ પણ કાળાં છે, કસ્તૂરી કાળી છે કે જે ખરા સમયે ચેતન-શક્તિ મેળવી આપવાનું કામ કરે છે,

-શાશ્વત ગિરિ મહિમા :-

આંબાની ડાળે બેસતી કોચલ પણ કાળી છે કે જેનો ટહુકાર  
કર્ણને બહુ જ મધુર લાગે છે, મરી-તીખાના દાણા કાળા છે  
જે ધોળા રંગના કર્પૂરની રક્ષા કરે છે, ફૂષણ મહારાજા કાળા  
હતા, શ્રી મલિનાથસ્વામી, શ્રી મુનિસુવ્રતસ્વામી, શ્રી  
નેમિનાથ અને શ્રી પાર્શ્વનાથ પ્રભુ પણ શ્યામ વર્ણના જગતમાં  
પૂજનિક છે, માટે કાળાપણું કોઇ પણ રીતે વખોડવા લાયક  
નથી. કદાચ તમને ધોળાશ ઉપર બહુ ભાવ હશે; પરંતુ  
ધોળા તો બગલાઓ ઘણા ફર્ચા કરે છે. વળી ધોળા રંગના  
માણસો તો ભૂતિયાં-કોઢીયાં જેવા લાગે છે તે શું સાર  
ગણાય ? અમે તો કહીએ છીએ કે જે માણસો બહુ ધોળા  
દેખાય તે પ્રાયે રોગનાં ગ્રાપાટામાં વ્હેલા સપડાઈ જાય છે,  
માટે ધોળાપણાનો એટલો બધો મહિમા વધારણો નહિ અને  
કાળાપણાને નિંદણો નહિ.”

આ સાંભળતાં જ ગોરી સ્ત્રીઓએ પ્રત્યુત્તર આયો  
કે- “જ્હેનો ! બહુ બોલવાથી શું વળે ? અમારા પગના  
અંગુઠાની બરાબરીમાં પણ તમે આવી શકો એમ નથી.  
સાંભળો ! ગંગાજળ ગોરું છે કે પવિત્ર ગણાય છે, સરોવરની  
શોભા વધારનારા હંસલાઓ ગોરા છે, શીતળતા અને  
સુગંધતા જેનામાં વસી રહેલી છે એવું ચંદન પણ ગોરું છે,

-: શાશ્વત ગિરિ મહિમા :-

મૃગલાઓમાં જે ગોરા વર્ણના હોય તે જમણા ઉત્તર્યા હોય  
તો સારાં શુક્લ ગણાય છે, શ્રી સુવિદ્ધિનાથ ભગવાન અને  
શ્રી ચંદ્રમભુસ્ત્વામી વર્ણમાં ગોરા છે, એટલે અમારી ઉજવળતા  
આગળ તમારં કાંઈ ચાલે તેમ નથી. જુઓ ! ચામર ઉજવળ  
છે, કમળ ઉજવળ છે, હાથીદાંત ઉજવળ છે, પુષ્પ ઉજવળ  
છે, દક્ષિણાવર્ત શંખ ઉજવળ છે અને છેવટમાં દી પણ ઉજવળ  
છે કે જે ધીના જ ગુણો સાંભળી તમે શાંત થઇ જશો.”

દીએ વાદે વાન, કાન પણ સરવા થાયે,

અંખે વાદે તેજ, ખરજ ને ખોડો જાયે;

જરા ન વ્યાપે અંગ, ટાંગ તન ધાત ન દ્યુજે,

કાયા ગહિ કટિબંધ, અર્થ આગળથી સૂર્યે;

મુખનું મંડન ધૂતસહી, હાંકચો હીંડે દેતો હડી;

ધૂતવિહૃણા જેહ નર, જાણો સુકી લક્કડી.

દોહરો - લક્કડ સરીખા તે નરા, જે નવિ પાખ્યા ધીહ;

ધૂત જુમંતા જે બન્યા, તે પંચાયણ સિંહ.

માટે હે કાળી-શ્વામવર્ણી બહેનો ! આ ઉજવળતાના  
એટલે ગોરાપણાના ગુણ સાંભળી છાનામાના બેસી રહો  
અને વાદવિવાદ છોડી ધો.

આ ચીતે પરસ્પરનો વિવાદ સાંભળી વચ્ચે એક વૃદ્ધ

:- શાક્ષત ગિરિ મહિમા :-

ડોશીમા બેઠા હતા તે બોલ્યા કે- “અરે છેનો ! ખાલી વાદ શા સાર કરો છે ? કાળી શી અને ગોરી શી ! રૂપથી મોટાઈ મનાતી નથી, પરંતુ ગુણાચી ગાણાય છે, માટે આ જગતમાં જે પુન્યકરણી વધારે કરે તે રૂપવંતી ગાણાય છે અને તે જ મોટી મનાય છે. સાંભળો.

સબળરૂપ સબળ શાણગાર, દાન શીળ તપ પાખે છાર; તેછનું રૂપ જગતમાંહે સાર, જે સ્ત્રી કરે નિત્ય પરઉપગાર.

જેનો ! જગતમાં એકલું રૂપ અને એકલો શાણગાર શા કામના છે ? ખરેખરી રીતે આ સાત “દદા” જેનામાં હોય તે સાચી અને મોટી મનાય છે. કહ્યું છે કે :-  
દયા, દાન, દમ, દે હનો દોષ, દોલત જાતાં ન કરે શોક;

દુઃખ ભાંજે પ્રેમે પારકું, દીનવચન બોલે મુખથકું,  
દુર્જન ઉપર ન કરે રીસ, તે સ્ત્રી પામે સબળ જગીશ;  
એ અંગ ધરતી સાતે દદા, રૂપવંતી તસ ભાખું મુદા.

આ રીતે બજ્જેનો વિવાદ શાંત કર્યો અને શ્રીસંદેશનેહપૂર્વક શ્રી સિદ્ધગિરિને ભેટવાની હોંશમાં અવિષ્ણુ પ્રયાણ કરવા લાગ્યો. સંદપતિ કુમારપાળ ભૂપાળ દેવગુરુની ભક્તિનો ઉત્તમ હ્લાવો લીધા કરે છે અને ભોજન સમયે

-શાશ્વત ગિરિ મહિમા :-

સર્વની સાથે બેસી દરેકની સંભાળ પ્રેમપૂર્વક કરીને સંધભક્તિ ઉત્તમ પ્રકારે કર્યે જાય છે. શ્રી સંઘમાં વિદ્યવિદ્ય જાતિના સ્વાદિષ્ટ પક્વાજ્ઞો સાથે ભાતભાતની રસોઇ હુંમેશા થયા કરે છે, જેનું વર્ણન લખતાં ટુંકમાં કવિ અધ્યભદાસ સમજાવે છે કે- “રાજ કુમારપાળના સંઘમાં થતા ભોજનનો લાભ લેનારાઓના દેહનો અને મુખનો વાન જરૂર બદલાઈ ગયા સિવાય રહે જ નહિ.” એટલે કે સંધભક્તિ કરવામાં જ્યાં ખર્ચનો હિસાબ જ રાખેલ નથી એવા ઉદાર દિલથી મહાન ખર્ચે કુમારપાળ ભૂપાળે સંઘ કાઢેલ છે.

કુમારપાળ રાજના સંઘમાં સાથે આવેલા શ્રાવક-શ્રાવિકા વર્ગમાંથી ધણા ભાગ્યશાળીઓ જુદી જુદી રીતે સંધભક્તિનો લ્હાવો લેતા જાય છે. ધવળ શોઠ, ધજા શોઠ, ધરમશી શોઠ, પાંચો શોઠ, પેથો શોઠ, પદમશી શોઠ, સુરો શોઠ, સંઘજી શોઠ અને શિવરાજ શોઠ આ સર્વે સંઘમાં પોત પોતાની શક્તિ મુજબ પુન્યના કાર્ય કરતા જાય છે. વરદ્ધ શોઠ, શ્રીમત્લ શોઠ, ભોજો શોઠ, ભાખર શોઠ, ભીમો શોઠ, હીરો શોઠ, હરખયંદ શોઠ અને હરપાળ શોઠ વિગેરે બહુ પ્રેમપૂર્વક સંઘમાં વૃદ્ધ તથા બાળકોની તપાસ રાખી તેમની સેવા-ભક્તિ કર્યે જાય છે. દેવો શોઠ તથા દુદો શોઠ સાકરનાં

:- શાશ્વત ગિરિ મહિમા :-

પાણીની પરબો મંડાવી સંઘભક્તિ કરે છે. આંબો શેઠ અને અબજુ શેઠ મોદકના હાટ મંડાવી સંઘમાં છાણી કરતા જાય છે. ખોખો શેઠ, ખેતશી શેઠ અને ખીમશી શેઠ હાથ પોલો રાખી ગુઘદાન દીધાં કરે છે. ભદ્રો શેઠ, ભૂપત શેઠ અને ભીમા શેઠ સંઘમાં સર્વને હંડાં પાણી પીવાની ભક્તિ કરે છે. થાવર શેઠ, થવરો શેઠ અને થોભણ શેઠ મુનિવરના પાત્રમાં આહાર વહોરાવી છાવો લે છે. જાવડ શેઠ અને ભાવડ શેઠ સકળ સંઘમાં દુધ અને દહિના દાઢાઓ વપરાવી ભક્તિ કર્યા કરે છે. સારંગ શેઠ, શિવજુ શેઠ અને શ્રીપાલ શેઠ ત્રિકાળ જિનેશ્વર પ્રભુની પૂજાનો લાભ લીધા કરે છે અને ભાણો શેઠ તથા લખમશી શેઠ શેરડી, કેળાં વિગેરે ફળો વહેંચીને સંઘભક્તિ કરે છે. આ રીતે “છ-રી” (“છ-રી” એટલે જે શાણની પછવાડે “રી” આવે તે- ૧. પાદચારી, ૨. સચિતપદિહારી, ૩. બ્રહ્મચારી, ૪. ભૂમિસંથારી, ૫. એકલાહારી, ૬. સમકિતધારી.) પાળતાં સિદ્ધગિરિની વાટે જતાં સહુ કોઇ કાંઈ ને કાંઈ આપીને સંઘભક્તિ, દેવભક્તિ ને ગુરુભક્તિનો અપૂર્વ છાવો લે છે.

શાવિકાવગ્માંથી પોતીબાઈ, પાંચીબાઈ, પાંખુડીબાઈ, વીરમતી અને વિમળાદે શેઠાણી, ગુણશ્રી અને કમળશ્રી,

-: શાક્ષત ગિરિ મહિમા :-

લાછલદે અને લખમીબાઈ, કોડીમદે અને કનકાદે શેઠાણી વિગેરે કિનપૂજા-ગુરુભક્તિ કરતાં અનેક પ્રકારના દાન દેતાં સંઘભક્તિ કર્યે જાય છે. આ રીતે શ્રી કુમારપાણ ભૂપાળનો સંઘ બહુ પરિવારથી તેમજ હૃદય, ગાય, રથ, પાલખી અને સુભટોથી શોભતો પાંચ પાંચ ગાઉએ પડાવ નાખતો જાય છે, તેમજ જ્યાં રાત્રિ પડી જાય ત્યાં શાંતિથી સ્થિરતા કરીને સંપૂર્ણ જયણા પૂર્વક ચાન્તાવિધિ સાચવતો શ્રી સંઘ પ્રયાણ કરે છે.

અહિં પ્રસંગોપાત કવિ અધ્યભદાસ જણાવે છે કે- “દરેક ધાર્મિક ક્રિયા યથાવિધિ જયણાપૂર્વક કરવાથી સંપૂર્ણ ફળને આપે છે એવું શ્રી કિનેશ્વર ભગવંતનું ખાસ કથન છે. એ સર્વદા ચાદ કરી તે પ્રમાણે વર્તન કરવાની ખાસ આવશ્યકતા સમજવી.”

“જયણાપૂર્વક કાર્ય કરવાથી કર્મ-મેલ ધોવાઈ જાય છે અને ધર્મની પુષ્ટિ થાય છે. દાન, શિયળ, તપ અને ભાવ વિગેરે સકળ કરણીમાં જયણાની ખાસ જરૂર છે. પોસણ, પ્રતિક્રમણ અને પૂજા કરતાં પણ જયણાની બહુ જ જરૂર છે. સાધુદ્વર્ધમાં પણ જયણાની મુખ્ય જરૂરીયાત છે. હાલતાંચાલતાં જયણાપૂર્વક દુંસરાપ્રમાણ આગળ જોઇને ચાલવાની જરૂર

છ. પડિલેહણા કરતાં, સંથારો પાથરતાં, માગ્રાદિ પરછવતાં,  
ઉઠતાં અને બેસતાં તથા ખાતાં પીતાં દરેક કરણીમાં વિધિ  
સાચવીને જયણાપૂર્વક કામ કરવાની જ પ્રભુની આજા છે.”

કહ્યું છે કે :-

ચયિધર્મમાં જયણા કહી, જીવજંત ઉગારે સહી;  
પડિલેહતાં ભણતાં સદહે, રખે જીવ મુજથી દુઃખ લહે.  
ઉઠતાં બેસતાં વળી, મુનિવર રાખે મતિ નિર્મળી;  
સંથારે જયણાએ સોચ, ધુંસરપ્રમાણે પંથે જોય.  
ઉભો રહી અધિ જયણા કરે, મધુર વચન મુખથી ઉચ્ચરે;  
ભુંજંતા નવિ બોલે જેહ, અધભ કહે અધિ સાચો તેહ.  
એણીપર્દે જયણા કરતો યતિ, તેને પાપ ન લાગે રતિ;  
તેમ શ્રાવકને જયણા ધર્મ, જયણા કરે તો શ્રાવક પર્મ.

કુમારપાળ ભૂપાળનો સંઘ સર્વ પ્રકારે જયણાપૂર્વક  
પ્રયાણ કરતો કરતો અનુક્રમે દંધુકા ગામે પહોંચ્યો, ત્યાં  
સંઘપતિ કુમારપાળ રાજ તરફથી આખા ગામમાં દરેક ઘરે  
થાળીમાં એકેક સોનામહોર મૂકીને છાણી કરવામાં આવી  
અને પોતે કરાવેલા “ગોલિકા-વિહાર” નામના જિનમંદિરમાં  
પ્રભુદર્શન, પૂજન આદિ ભક્તિ કરીને ત્યાંથી શ્રીસંઘ  
વળાચમારડી આવ્યો, જ્યાં બે મોટા પર્વતો ઉપર જિનમંદિરો

- : શાક્ષત ગિરિ મહિમા :-

કરવા માંડેલા તે તૈયાર થયેલાં હોવાથી એકમાં શ્રી અષ્ટભેદેવ ભગવાનની અને બીજામાં શ્રી પાર્વતીનાથ પ્રભુની ભવ્ય મૂર્તિ પદ્ધરાવી સ્નાનાદિ મહોત્સવ કરીને શ્રીસંઘ ત્વાંથી આગળ ચાલ્યો.

વળા-ચ્યમારડી એટલે વલ્લભીપુરની સીમમાં શુદ્ધ અને વિશાળ જગ્યાએ શ્રીસંઘે પડાવ કર્યો. તેમના આવાગમનના સમાચાર ચારે તરફ ફેલાતાં અનેક ઋત્રી-પુર્ણો જૈન અને જૈનેતર શ્રી સંઘના અને સંઘપતિના દર્શનાર્થે આવવા લાગ્યા. જેમનો સક્કાર કુમારપાળ રાજ તરફથી બહુ પ્રકારે થતો હતો અને જે જે લોકો તરફથી ધર્મકાર્યને માટે જે કાંઈ માગણી થતી હતી તે સર્વને ઉત્સાહપૂર્વક યોગ્ય રકમ આપવા માટે ભંડારીને હુકમ થતો હતો.

સકળ સંઘનો પડાવ થયા બાદ ત્યાં ઉભા શ્રી શેષુંજયગિરિના દર્શન કુમારપાળ ભૂપાળ સહિત સકળ સંઘે ભાવપૂર્વક કર્યા. ત્યાર પછી પગે ચાલીને અનુકૂમે શ્રી સંઘ તળાટી નજીદીક પહોંચાતા પ્રથમ તો ગિરિરાજને સોના રૂપાના કુલથી તેમજ ઉત્તમ પરવાળા અને મોતીથી વધાવી તેની આગળ અક્ષતાદિ સામગ્રીથી સ્વર્ણિક આલોખ્યા. સહુ કોઇરે ચથાશક્તિ તેની ઉપર સોનામહોર-રૂપાનાણું વિગેરે ચઢાવ્યા

:- શાશ્વત ગિરિ મહિમા :-

અને ઉલ્લાસપૂર્વક ચૈત્યવંદન કર્યું. મહોત્સવપૂર્વક પૂજા ભણાવી અને બહુ પ્રકારે ગિરિજાની ભક્તિ કરી.

અનુકુમે સકળ સંધે કુંગાર ઉપર ચઠવાનું શરૂ કર્યું. રસ્તામાં આવતી સર્વ દહેરીઓની અંદરની પાદુકાઓની કેશર, ચંદન, પુષ્પાદિકથી પૂજા કરી અને વંદન કરતાં કરતાં મુખ્ય ટુંકે પહોંચ્યા. મૂળનાયક શ્રી અધિકારી મનોહર મૂર્તિ નીછાળતાં અપૂર્વ ઉલ્લાસ જાગૃત થયો, રોમેરોમ વિક્રસ્વર થઇ ગયા, જન્મ કૃતાર્થ થઇ ગયો અને સકળ યાત્રાળસહિત કુમારપાળ ભૂપાળ અને પહુંરાણી ભોપળદેવીએ ત્રણ પ્રદક્ષિણા દઈને ભાવપૂર્વક વંદણા કરી, મહિ મૌતીના થાળ ભરીને પ્રભુને વધાવ્યા.

યુગાદીદેવ શ્રી અધિકારી મનોહર સુતિ કરીને રસના (જીબ) પવિત્ર કર્યા બાદ સૂરજકુંડ અને શેરુંજુ નદીના નિર્મિત જળથી જ્ઞાન કરી કુમારપાળ સહિત સર્વાએ પ્રભુપૂજા વિધિપૂર્વક આદરી. પ્રથમ પ્રભુજુને મોરપીછી વડે પ્રમાર્જને સુવર્ણના અને રૂપાના કળશો વડે અનેક ધારાથી જળ અભિષેક કર્યો અને મેર શિખર ઉપર દંદ્રો પ્રભુને જહવરાવીને જેમ હ્લાવો લે છે તેમ અપૂર્વ લાભ લઈને સુકોમળ વાત્ર વડે અંગ લુછીને કેશર, ચંદન, પુષ્પ, ધૂપ,

- : શાક્ષત ગિરિ મહિમા :-

દીપ, અક્ષત, ફળ અને નૈવેદની ઉત્તમ સામગ્રીથી પૂર્ણ આહુલાદ સહિત એકાગ્ર ચિત્તથી અષ્ટપ્રકારી અને સતતપ્રકારી પૂજા કરી. એ રીતે પ્રભુની દ્રવ્યપૂજાનો હાવો લીધો.

દ્રવ્યપૂજા કર્યા બાદ શ્રી આદીશ્વર દાદાની સંભૂતસૂર્યિશ્રી હેમચંદ્રાચાર્ય સહિત કુમારપાળ ભૂપાળ વિગેરે અવગ્રહ સાચવીને ચૈત્યવંદન કરવા બેઠા. શ્રી હેમસૂર્યિ મહારાજે ચૈત્યવંદન શરૂ કર્યું તેમાં ધનપાળ કવિકૃત “અષ્ટભપંચાશિકા” પ્રભુ પાસે અત્યંત આહુલાદપૂર્વક કહીને રસના પવિત્ર કરી, તેમજ કુમારપાળ રાજ વિગેરેએ એક ચિત્તથી શ્રવણ કરવા વડે શ્રવણને પવિત્ર કરી આત્માનો ઓર આનંદ અનુભવ્યો. આ વિધિ સંપૂર્ણ થઇ રહ્યા બાદ કુમારપાળ રાજએ વિનયસહિત ગુરુ મહારાજને પૂછ્યું કે- “હે સાહેબ ! આપ તો વિદ્વાન, જ્ઞાની, પ્રખર પ્રતિભાશાળી અને કળિકાળસર્વજ્ઞાનું બીર્દ ધરાવનાર છો તેમજ શ્રેષ્ઠ કવિ પણ છો, તો આપને આ શ્રાવકની બનાવેલી (ધનપાળકૃત) પ્રભુસ્તુતિ બોલવાનું શું પ્રયોજન લાગ્યું ? આપે આપની બનાવેલી સ્તુતિ કેમ કહી સંભળાવી નહીં ?”

તેના સમાધાન અર્થે શ્રી હેમસૂર્યિ મહારાજ બોલ્યા કે:- “હે રાજન ! શ્રી અષ્ટભપંચાશિકા ભલે ધનપાળ શ્રાવકની

- : શાક્ષત ટિક્રિ મહિમા :-

રચેલી છે, પરંતુ તેમાં પ્રભુગુણા, પ્રભુપ્રેમ અને પ્રભુભક્તિની ગુંથળી હૃદયના ઉમળકાથી ભાવપૂર્વક એટલી સરસ રીતે કરેલી છે કે તે પ્રેમ, તે ભક્તિ અને તે ગુણના અમીરસભર્યા ઝરણાં મ્હારામાંથી નીકળવા તદ્વન અશક્ય છે. તે કવિ ધનપાળકૃત સ્તુતિ અને મ્હારી બનાવેલી સ્તુતિમાં હું તો કહું છું કે જેમ એક કોડી અને કંચનમાં, ચંદન અને સુકા ઘાસમાં, રાજ અને સેવકમાં, પાણી અને દુધમાં, મહિષ અને હાથીમાં, સસલા અને સિંહમાં, કીડી અને કુંજરમાં, ખદ્યોત અને સૂર્યમાં, સામાન્યજળ અને ગંગાજળમાં, નિર્દ્દિન અને ધનિકમાં, નિર્ગુણી અને ગુણીમાં તારા અને ચંદ્રમાં, દીપક અને દિનકરમાં, કૃપણ અને દાતારમાં, ખોટા અને સાચા મોતીમાં પીતળ અને હેમમાં હરિહરાદિ દેવો અને શ્રી બિનેશ્વર દેવમાં જેમ મહાન અંતર રહેલ છે, ગુણમાં મોટો ફેર રહેલો છે અને તરતમતા રહેલી છે તેવી જ રીતે કવિ ધનપાળ અને મ્હારા માટે સમજી લેવું. ખરેખર કવિ ધનપાળની બરાબરીમાં હું આવી શકું તેમ નથી. કવિ ધનપાળ તો બુદ્ધિ વિશાળ પંડિત પુરુષ હતા, જેમને શ્રી અધભદેવ પ્રભુ સાથે અપ્રતિમ પ્રેમ, અવિહંડ રંગ અને અભિતીય ભાવ જેમ કોયલને સહકાર સાથે, ચાતકને મેદાની

-: શાક્ષત ગિરિ મહિમા :-

સાથે અને ગૌતમગાણધરને શ્રી વીરપ્રભુની સાથે લાગ્યો હતો તેમ સંપૂર્ણ જાય્યો હતો. એ ભક્તિ-રાગથી તેમણે “શ્રી અધભપંચાશિકા” ઉત્તમ ભાવવાઠી શાષ્ટોમાં રચેલી છે, માટે તે ધનપાળ કવિ તો મહાન પુરુષની પંક્તિમાં પંકાઇ ગયા છે અને તેમની રચેલી “અધભપંચાશિકા” શ્રી અધભદેવ સન્મુખ કહેતાં ભક્તિભાવની વિશેષ જાગૃતિ થાય તેમ છે.”

કુમારપાળ ભૂપાળ અને સર્વ શ્રોતાવર્ગ શ્રી હેમસૂરિ મહારાજની આટલી બધી લઘુતા જોઈ પ્રશંસા કરવા લાગ્યા અને બોલ્યા કે- “જગતમાં જેઓ ગુણના ભંડાર છે તે પુરુષો સ્વાભાવિક રીતે સ્વગુણની જ્લાદા બીલકુલ કરતા જ નથી, પરંતુ હંમેશા પરગુણની પ્રશંસા જ કર્યા કરે છે. સન્તપુરુષો આપબડાઇ કર્દિ કરતા જ નથી. એમના ગુણો તો આપોએાપ ઝળકી ઉંડે છે અને તેઓ પૂજનીય બને છે. ભલે સાકર ન કહે કે હું સ્વાદમાં ગળી છું પણ તેમાં રહેલી મીઠાશ છાની રહે તેમ નથી. ભલે ચંદન ન કહે કે મહારામાં શીતળતા ભરેલી છે પરંતુ તેની શીતળતા તો સ્વાભાવિકપણે અગટ થયા વગાર રહે જ નહિ. ભલે અમૃત ન કહે કે મહારામાં અનુપમ મીઠાશ છે પરંતુ તેનો મહાન ગુણ અને રસમધુરતા જગતમાં છુપા રહી શકે જ નહિ, તેવી જ રીતે સૂર્જિશ્રી હેમચંદ્રાચાર્યને ધન્યવાદ ઘટે છે કે જેઓ કળિકાળસર્વજ્ઞનું

-: શાશ્વત ગિરિ મહિમા :-

બિરુદ્ધારી પ્રખર પંડિત પુરુષ છતાં સ્વગુણની પ્રશંસા નહિ કરતાં લઘુતા બતાવી રહ્યા છે; પરંતુ તેમના ગુણો અને તેમની ઉત્તમતા ટાંકી રહે તેમ નથી; સ્વચ્છમેવ પ્રગાઠ થાય છે.”

તે વખતે કુમારપાળ મહારાજ શ્રી હેમસૂરીશ્વરના ગુણની સર્વ સમક્ષ પ્રશંસા કરતાં કહેવા લાગ્યા કે- “જેમ તીર્થમાં શ્રી શાર્ઙુજ્ય તીર્થ, દેવોમાં ઈંદ્ર, હાથીમાં ઐરાવણ, સમુદ્રમાં ક્ષીરસમુદ્ર, રાજાઓમાં રામ, છ આરામાં સુસમુસમા નામે આરો, શિયળવંતી સ્ત્રીઓમાં સીતા, બાળાવળીમાં અર્જુન, જળમાં ગંગાજળ, સર્વ નારીઓમાં શ્રી મરદેવા માતા, પથ્યરોમાં હીરો, અશ્વોમાં રવિના અશ્વ, પશુઓમાં સિંહ, દુગ્ગાળામાં ભહિષ્ણી, નાણામાં સોનામહોર, માની પુરુષોમાં દશાર્થિભદ્ર, દાની પુરુષોમાં શ્રી શાંતિનાથ ભગવાન અને ભોગી પુરુષોમાં શ્રી શાલિભદ્ર અધિકપણે શોભે છે તેમ આ સમયે શ્રી હેમસૂરિ મહારાજ શોભી રહ્યા છે. તેમની સરખા અન્ય કોઇ ઉત્તમ યોગી પુરુષ છે જ નહિ.”

હેમ સમો યોગી નહિ, ભાખે કુમર નરિંદ;  
હેમ કહે હું નહિ ભલો, ભલો તે અધભ જિણંદ.

-: શાક્ષત ગિરિ મહિમા :-

જસ પદ પુન્ય પસાઉલે, શેંગુંજાગિરિ હુઅો સાર;  
 રાયણ રૂપે સમોસચારી, પૂર્વ નવાણુ વાર.  
 હેમસૂરીશ્વર બોલ્યા કે- “હે રાજન્ ! આપ મ્હારી  
 સ્તુતિ કરી મને ભલો કહો છો, પરંતુ તે અચુક્ત ઘટના છે.  
 જગતમાં મ્હારા કરતાં તેમજ સર્વ કરતાં ભલામાં ભલા  
 અનંત ગુણથી ભરેલા, અનંતા જીવોનો ઉદ્ધાર કરવાવાળા,  
 પરમ પુન્યવંત પ્રભુ શ્રી અધિભજિણંદ છે કે જેમના પુન્યપ્રભાવે  
 શ્રી શાંતિચિર્ય પૃથ્વીતળમાં પંકાણું છે અને જેમણે પૂર્વ  
 નવાણુ વાર આવી, રાયણવૃક્ષ તળે સમવસરી આ તીર્થને  
 પાવન કરેલ છે. એ કારણથી આ રાયણવૃક્ષ પણ પૂજનિક  
 છે, એનો મહિમા પણ અપૂર્વ છે, માટે ચુગલાદર્મનિવારક  
 શ્રી આદીશ્વર ભગવાનની ત્રિકરણ યોગે ભક્તિ કરીને  
 અને રાયણવૃક્ષની શીતળ છાયા નીચે બેસી પરમાત્માનું  
 દ્વારા ધરીને આત્મકલ્યાણ કરી લ્યો.”

આ હક્કિકત સાંભળી કુમારપાળ રાજ વિગેરેએ  
 રાયણવૃક્ષને પ્રદક્ષિણા દઈને આદીશ્વર પ્રભુનાં પગલાની  
 પૂજા કરી. વળી ફરીથી શ્રી અધિભજિણંદની ભક્તિમાં  
 લયલીન થઇ જઈ અનુપમ આંગી રચી પ્રભુના નવ અંગે  
 નવ લાખની કિંમતના નવ રલ્યો મૂક્યાં, સુવર્ણમય એકવીશ

:- શાશ્વત ગિરિ મહિમા :-

ધ્વજાઓ ચટાવી, ચામર છત્ર વિગેરે પ્રભુ પાસે દરી, મહિના,  
માણેક, મુક્તાફળના થાળો ભરી ભરીને અપૂર્વ ઉત્ત્સાસ  
વડે પ્રભુને વધાવ્યા અને એકચિંતે પ્રભુસ્તુતિ બહુ પ્રકારે  
કરીને પૂર્ણપૂર્ણો હાવો લીધો.

આ રીતે શ્રી જિનેશ્વર ભગવંતની અપૂર્વ ભક્તિ  
કુમારપાળ રાજાએ કરી તે જોઈને તે વખતે ત્યાં ઉભેલો એક  
ચારણ બોલી ઉઠ્યો કે- “શ્રી આદીશ્વર દાદાની એક પુષ્ણની  
પૂજા પણ શિવપદવી આપે છે, એટલે ખરેખર શ્રી જિનેશ્વર  
દેવ તો જગતમાં બહુ જ ભોળા દેખાય છે.”

તે ચારણ વળી સ્તુતિ કરતાં બોલ્યો કે- “જગતમાં  
શ્રી અધભર્મદેવ સમાન પૂજનિક અન્ય કોઇ દેવ નથી અને તે  
જિનેશ્વર ભગવંતની અપૂર્વ ભક્તિ કરનાર રાજા કુમારપાળ  
જેવા કોઇ રાજા નથી. ખરેખર મહારે તો આજે શ્રી આદીશ્વર  
ભગવાનના દર્શન અને વળી રાજા કુમારપાળનો મેળાપ  
થતાં મહારા દૃઢ-દાચિદ્રરૂપી અંતરાય આજથી જ સર્વ નાસી  
ગયા છે.” તેમ કહી તે ચારણ કુમારપાળ ભૂપાળની સ્તુતિ  
કરતાં કહેવા લાગ્યો કે :-

દીપક જુમ તું દિનમહિના, તું સાયર તું વીર;  
કલ્પદ્રુમ જાણી કરી, કિમ જાયું જ કરીર.

-: શાક્ષત ગ્રાહિ મહિમા :-

કવિત.

મિલે જો ગંગા નીર, તો અવર નીર કાં પીજે ;

મિલે મિત્ર જો ઉંચ, નીચ સંગતિ કાં કીજે .

મિલે પઠંગ<sup>૧</sup> પાખર્યો, તો પાળો<sup>૨</sup> કુણ દોડે ;

મિલે જો હીરના ચીર, તો અંગ ખાસર<sup>૩</sup> કુણ ઓડે .

મિલે છાંચ સુરતરતણી<sup>૪</sup>, બબુલ<sup>૫</sup> કહો કેમ જાઇએ ;

સુકવિ કહે મંદિર તજુ, મટીમાંહે<sup>૬</sup> કહો કુણ રહે ?

( ૧. પઠંગ - અશ્વ, ૨. પાળો - પગે ચાલતો, ૩.

ખાસર - ભાડાં-ખાઈના વસ્ત્ર, ૪. સુરતરતણી - કલ્યવૃક્ષની,

૫. બબુલ - બાવળની છાયાએ, ૬. મટીમાંહે - ગુંપડીમાં.)

વળી તે ચારણ બોલ્યો કે- “સરોવરનાં મીઠાં જળ  
મળે તો કુવાનું પાણી મેળવવા મહેનત શું કામ કરીએ ?  
અને શાલદાલનાં સારાં ભોજન મળે તો કોદરા શા માટે  
આરોગીએ ? ત્રિલોકનાયક શ્રી અરિહંત સરીખા દેવ મળે  
તો અવર દેવની સેવા શા માટે કરીએ ? ઉત્તમ જન-પંડિત  
પુરુષની સોબત મળતી હોય તો મૂર્ખના ટોળામાં શા માટે  
જઇએ ? તેવી જ રીતે ઉદાર ચિત્તવૃત્તિના કૃપાળુ રાજન् !  
આપ જેવા દાનેશ્વરીના દર્શન કર્યા પછી હવે બીજાની ચાચના  
તો શા માટે કરવી જ પડે ?” આ પ્રમાણેની સ્તુતિ સાંભળતાં

:- શાંકત ગિરી મહિમા :-

કુમારપાળ રાજાએ સંતુષ્ટ થઇને તે ચારણને નવ લાખ  
ટકાનું દાન દીધું.

શ્રી શાંજ્ય તીર્થ ઉપર કુમારપાળ ભૂપાળ મહિનાન  
સંઘ કાઢીને આવેલ હોવાથી અનેક પ્રકારની ધામધૂમ  
ભક્તિપૂર્વક ચાલી રહી હતી. પછી વિધિસર તીર્થમાળની  
બોલી પણ તે અવસરે બોલવી શરૂ થઇ, જેમાં વાગ્ભણ  
મંત્રીએ પ્રથમ ચાર લાખ સોમેયા કહીને શરૂઆત કરી.  
ત્યારે કુમારપાળ રાજાએ આઠ લાખની ઉછામણી કરી,  
ફરી વાગ્ભણ મંત્રીએ સોળ લાખ કહ્યા તો રાજાજુએ બગ્રીશ  
લાખ કર્યા. આ રીતે તીર્થમાળ પહેરવાની ઉછામણી થતી  
જાય છે તે વખતે ત્યાં ચાત્રાએ આવેલા એક શ્રાવકે એકી  
સાથે સવા કરોડની બોલી ઉત્સાહપૂર્વક કરી, જે સાંભળતાંની  
સાથે જ રાજા કુમારપાળે તે શ્રાવકને તુરત જ બોલાવી પાસે  
બેસાડ્યો, અને તેનો અપૂર્વ ઉત્સાહ અને પ્રેમ-ભાવ જોઈને  
બહુ જ અનુમોદના કરી. છેવટે સવા કોડની માગણીની  
બોલી મંજુર થઇ અને તે શ્રાવકને આદેશ આપવામાં આવ્યો.

અપૂર્વ ઉત્સાહપૂર્વક સવા કરોડની બોલીથી  
તીર્થમાળનો આદેશ લેનાર આ શ્રાવક શ્રી મહુવા નગરના  
હંસમંત્રીના પુત્ર શેઠ જગડુશાહ હતા, જેણે તે તીર્થમાળ

લઇને તે છ્હાવો પોતાની માતુશ્રીને લેવરાવ્યો અર્થાત તે તીર્થમાળ સકળ સંઘ સમક્ષ પોતાની માતુશ્રીને પહેરાવી તીર્થભક્તિનો ઉત્તમ લાભ લીધો. અહો ! ધન્ય છે આવા પુનને ! કે જેણે આવી માતૃભક્તિ કરી પોતાની માતાનો જન્મારો સફળ કરાવ્યો. કવિ અધ્યભદાસ કહે છે કે :-

ચોપાઈ.

માતા સમ નહિ તીરથ કોય, સ્વર્ગ મૃત્યુ પાતાલે જોય;  
જેણે માની પોતાની માય, સકળ તીર્થ ઘર બેઠાં થાય.  
જેણે માતાએ ઉદર ધર્યો, મળમૂર્ત ધોઇ ચોખ્ખો કર્યો;  
તે માતાના પૂજે પાય, ગુણ ઉસિંગણ તો નવિ થાય.  
સોવન બરાબર તોલે જોય, ખંધ ધરી કરે તીરથ સોય;  
ઇંદ્રમાળ પહેરાવે માય, ગુણ ઉસિંગણ કીમે ન થાય.  
પગ ધોઇને પાણી પીઅએ, અમૃત કવળ માતા મુખ દીઅએ;  
દેવ ચિવર પહેરાવે જોય, ગુણ ઉસિંગણ તો નવિ હોય.

આ રીતે શેઠ જગડુશાહે માતૃભક્તિ નિમિત્તે  
ઇંદ્રમાળનો અપૂર્વ છ્હાવો લેવરાવી તુરત જ બોલીની કિંમતનું  
સવા કરોડનું મૂલ્યવાન એક રલન ત્યાં જ શ્રી સંઘને આપી  
દીદું. આ બનાવથી કુમારપાળાદિ સર્વે તેની બહુ મૃશંસા  
કરવા લાગ્યા અને શ્રી હેમસૂરિ મહારાજના ઉપદેશથી શ્રી

:- શાશ્વત ગીતિ મહિમા :-

શાંજું જ્ય તીર્થની ચાગ્રાનો મહાન લાભ પ્રાપ્ત થવાથી ગુરુસ્તુતિ  
કરવા લાગ્યા. શ્રી કૈન ધર્મની અનુમોદના કરતાં કુમારપાળ  
ભૂપાળ બોલ્યા કે :-

કૈન ધર્મ વિણ પૃથ્વીરાજ, તેહથી ન સરે એકે કાજ;  
અરિહંત વિના અલુણું ઘણું, શ્યું કીજે ચક્રવર્તીપણું.  
આભોગન (ચક્રીતા ભોગ) ચક્રીતણો, પામ્યા અનંતીવાર;  
કૈન ધર્મ વિના વળી, જાણો સહુ અસાર.

આ પ્રમાણે કુમારપાળ ભૂપાળે આહલાદમાં આવી  
જતાં વિશુદ્ધ ભાવથી શ્રી કૈન ધર્મની પ્રશંસા કરી અને ગુરુ  
શ્રી હેમસૂર્ચિ મહારાજને વંદન કર્યું તે સમયે સૂરીશ્વરે  
રાજાજુના મસ્તક ઉપર હાથ મૂક્યો અને કહ્યું કે-  
“ત્રિભુવનપાળના કુળમાં દીપકસમાન ! તમોને ધન્ય છે !  
અહો ! ધન્ય છે ! તમારી પુન્યરાશીને કે તમો કૈન ધર્મરૂપી  
ચિંતામણિરલન પામ્યા !” આ અવસરે રાજ કુમારપાળના  
મસ્તક ઉપર સૂરિશ્વીએ હાથ મૂકેલો જોઈને ત્યાં ઉભેલો  
એક ચારણ બોલ્યો કે- ‘હે પૃથ્વીનાથ ! સાંભળો. જગતમાં  
આવા પ્રકારની ઘણી વાતો અસંભવિત ગણાય છે.

મેદ રૂપ કાળું ધર્યી, આપે ઉજજવળ નીર;  
પશુ ગાય તરણા ચરે, આપે અમૃત ખીર.

કસ્તૂરી કાળી સહી, ઉપની માઠે ઠામ;  
 ઉંચો એ પરિમલ બહુ, આવે ધણાને કામ.  
 મુક્તાફળ તેજે વસ્યો, કુંજરતણે કપાળ;  
 નરનારી નૃપતિ ખુશી, તેછનું રૂપ નિહાળ.  
 આ રીતે આ વસ્તુઓમાં જેમ અસંભવિતપણું રહેલું  
 છે તેમ જે ગુર હેમસૂરીંદના પાદમાં સહુ કોઇ શિર ગૂકાવી  
 નમસ્કાર કરે છે, તે હેમસૂરીંદનો હસ્ત હે રાજન ! આ  
 વખતે આપના મર્સ્તક ઉપર પડેલો જોઇ મને ખરેખર  
 અસંભવતા જ લાગે છે.' આ પ્રકારની ઘટના કરી તે કવિ  
 બોલ્યો કે:-

હેમ તુમારા કર નમું, જીહાં અનંતી અદ્ધિ;  
 જેહ ચંચા હેઠે મુંહે, તીહાં ઉપને સિદ્ધિ.

અર્થાત જ્યાં હેમસૂરિ મહારાજનો હસ્ત પડે છે ત્યાં  
 અદ્ધિના દગલા થાય છે અને શ્રી હેમસૂરીશ્વરના હાથ નીચે  
 જે ચંપાય છે એટલે જેના ઉપર સૂરીશ્વરનો હાથ આવી પડે  
 છે તેને તો સર્વ પ્રકારની સિદ્ધિ આવી મળે છે.

વળી તે ચારણ હેમસૂરિ મહારાજની સ્તુતિ કરતો  
 કહેવા લાગ્યો કે- "જગતમાં ધાણ પુરુષો થઈ ગયા છે તેમાં  
 કાંઈને કાંઈ ખોડ-ખામી તો કહેવાણી છે. જેમકે-શુક્રાચાર્ય

સુરગુરુ એક આંખે કાળા હતા, સૂર્ય તેજસ્વી છે પરંતુ ઘસાતો  
ભાય છે, ચંદ્રમા ભલે શીતળ છે પણ ગળતો ભાય છે, બલિરાજા  
જો કે બહુબળીઓ કહેવાતો હતો છતાં તેને બંધાવું પડ્યું  
હતું, અર્જુન મહાન् બાળાવળી તરીકે પંકાળો હતો છતાં  
વ્યંડળ (નપુંસક) ના રૂપમાં રહેવું પડ્યું હતું, અરણિક  
મુનિવર કામદેવના ઝપાટામાં ઝંપલાણા હતા, સમુદ્રને મંથાવું  
પડ્યું, કૃષ્ણ કાળા કહેવાણા, કેશરીસિંહને મેઘગર્જના અસહ્ય  
લાગવાથી મર્યાદા પછાડી મરવું પડે છે, રાવણ બળવાન  
હતો પરંતુ પરલ્લીહરણના પ્રતાપે મર્યાદા હિત થઈ ગયો,  
શેખનાગ પૃથ્વીને ઝીલી રહ્યો છે એમ કહેવાય છે પણ તેનામાં  
ગેર ભરેલું છે, રાહુ ઘડરહિત છે, ચંદ્રશ્ર સૂર્યિમાં બહુ જ  
રીસ હતી, બ્રહ્મા પ્રજાપતિ એટલે કુંભાર તરીકે પંકાળા,  
રહનેમિએ રાજેમતિ પાસે ખોટી યાચના કરી લાંછન  
લગાડ્યું, ભરત મહારાજાએ લોભને વશ પડી પોતાના  
બાન્ધાવ બાહુબળી સાથે મોટું યુદ્ધ આદર્યું, અધાટાભૂતિ  
મુનિએ કપટથી આહાર વહોર્યો, આદ્રકુમાર દીક્ષા લીધા  
પછી ફરીથી સંસારી થદ્ય પુત્રસ્નેહે સુતરના તાંત્રે બંધાતાં  
બાર વરસ સુધી ગૃહવાસમાં પડી રહ્યા, પાતાળમાં રહેલા  
કાળીનાગને પણ નથાવું પડ્યું, પાંડવો મહાપરાક્રમી હતા

:- શાશ્વત ગિરિ મહિમા :-

તો પણ બાર વર્ષ વનવાસ વેઠી એક વર્ષ સંતાવું પડ્યું, દશાર્થભદ્રને માન અહંકાર આવી ગયો, પ્રસજ્ઞચંદ રાજ્યિ જેવા દુર્યોગને ચડી ગયા, નંદીષેણે શ્રીવત્તલભ થવાનું નિયાણું બાંધ્યું, કંડરીક સંયમથી પતિત થયા, સનકુમાર ચક્રવર્તીને રૂપનો મદ થયો, સેલગસૂરિ યોગથી મુક્ત થયા, નંદીષેણે વેશયાને ત્યાં રહી ચાન્દિએ ખંડિત કર્યું, બાહુબળી માનરૂપી વેલડીએ વીંટાઈ ગયા, કચ્ચા શેઠ મોહથી પરઘરે પડ્યા રહ્યા, ટંટણમુનિ જેવાને આહારની મુશ્કેલી પડી, ગજસુકુમાળના મસ્તક પર સોમિલ સસરે અંગારા ભર્યા, નળરાજ ધૂતના વ્યસની થયા, ભીમ બહુ જ જબ્જ પુરુષ તરીકે પંકાયેલ છતાં રસોઇયા તરીકે રહેવું પડ્યું અને હરિશ્ચંદ જેવા સત્યવાદીને નીચાને ઘરે પાણી ભરવું પડ્યું. આ રીતે કાંઈ ને કાંઈ ખામીનો અનુભવ ઉપર્યુક્ત દ્રષ્ટાંતોમાં જણાઈ આવે છે.”

વળી ગુરુ શ્રી હેમસૂરિની સ્તુતિ કરતાં તે ચારણ કહેવા લાગ્યો કે :-

હેમ સમો મુનિવર નહિ, જેણે પ્રતિબોધ્યો રાય;

જલચર થલચર જીવની, તેં કીધી રક્ષાય.

પંખીને પરાભવ નહિ, જેહને મસ્તક હેમ;

- : શાસ્કત ગિરિ મહિમા :-

ચારણ કહે તુમ દરિશણે, મુજને હુઅો બહુ પ્રેમ.  
 આ રીતે તે ચારણની બહુ પ્રકારની સ્તુતિ સાંભળી  
 કુમારપાળ રાજાએ ખુશી થઈને તે ચારણને પણ નવ લાખ  
 ટકાનું દાન દીધું અને ઉત્તમ કપડાં વિગેરેની પહેરામણી  
 કરી સંતુષ્ટ કર્યો.

હવે સકળ સંધ અને હેમસૂર્દિ મહારાજ સહિત  
 સંઘપતિ કુમારપાળ શ્રી શાંતુજ્યની પાંચમી ટુંક જે  
 ગટગિરનારના નામથી સુપ્રસિદ્ધ છે ત્યાં જવા માટે  
 પાલીતાણા નગરથી નીકળ્યા. રસ્તામાં ગામેગામ શ્રી  
 બિજેશ્વરદેવને જુહારતાં અનુકૂમે ગિરનારજુ પહોંચ્યા અને  
 ગિરિવરને નિહાળતાં જ મોતીના થાળ ભરી ભરીને વધાવવા  
 લાગ્યા. પછી સકળ સંધ સહિત સંઘપતિ કુમારપાળ અને  
 ગુરુ શ્રી હેમસૂર્દીંદ્ર વિગેરેએ ગિરનાર તીર્થ ઉપર ચડવું શર્દ  
 કર્યું. તે સમયે તે પર્વત સહેજ ચલાયમાન થયો. અહિં કવિ  
 અધ્યભદાસ ઘટના કરતા જણાવે છે કે “શ્રી ગિરનાર પર્વત  
 ઉપર આજે આવા ઉત્તમ પુન્યશાળી પુરુષનાં પગલાં પોતાની  
 ઉપર પડવાથી પાવન થયાના હર્ષના આવેશમાં આવી જઈને  
 નાચ્યા કરે છે. ખરેખર જ્યાં મહાન પુરુષનો અવતાર થાય  
 તે નગરને પણ ધન્ય છે, તેમજ આવા પર્વતને પણ ધન્ય છે

કે જ્યાં પવિત્ર પુરુષનાં પગલાંનો સ્પર્શ થયા જ કરે છે.”  
 કુમારપાળ ભૂપાળે ગિરિપ્રકંપનું કારણ પૂછતાં સૂર્યમહારાજે  
 કહ્યું કે- “આ ગિરિ ઉપર ચડતાં માર્ગમાં ‘કોટિશિલા’ ને  
 છગ્રશિલા’ નામની બે શિલાઓ આવે છે, તે બે પુન્યશાળી  
 પુરુષોના સાથે ચડવાથી કદાચ પડે એવી વૃદ્ધજનોની વાણી  
 છે, તે માટે આપણે આગળ-પાછલ ચડવું ચુક્ત છે.” તે  
 સાંભળી વિનયવંત કુમારપાળ રાજાએ સૂર્યમહારાજને પ્રથમ  
 ચડવાનું કહ્યું અને તેઓ પાછળ પાછળ ચટ્યા.

અનુકૂમે શ્રી ગિરનારજુ ઉપર ચટીને શ્રી નેમિનાથ  
 ભગવાનને ભાવથી ભેટી અષ્ટદ્રવ્યની ઉત્તમ સામગ્રી સહિત  
 અતિ આહ્લાદવડે સંપૂર્ણ ભક્તિભાવથી સકળ સંઘ સાથે  
 કુમારપાળ મહારાજાએ પ્રભુપૂજા કરીને પોતાના જન્મને  
 કૃતાર્થ કર્યો. શ્રી હેમસૂરિ મહારાજે ઉપદેશ દ્વારા જણાવ્યું કે  
 :-

વસુધાનું ભૂખણ તે સહી, ખરી સંપદા તેછની કહી;  
 જગમાં જીવ્યા તે પરમાણ, સંઘપતિ તિલક ધરાવે જાણ.

શ્રી ગિરનારજુનું વર્ણન કરતાં ગુરુમહારાજે જણાવ્યું  
 કે- ‘આ દૈવતાચળ શ્રી શાંત્રંજયની પંચમગતિદાચક પાંચમી  
 ટુંક શાસ્ત્રમાં કહેલી છે અને તેનું નામ પ્રથમ આરે શ્રી

:- શાશ્વત ગિરિ અહિમા :-

કેલાસગિરિ, બીજે આરે શ્રી ઉજ્જયંતગિરિ, ત્રીજે આરે શ્રી વૈવતગિરિ, ચોથે આરે શ્રી સ્વર્ણગિરિ અને પાંચમે આરે ગઢ ગિરનાર એ રીતે સુપ્રસિદ્ધ છે. છૃંગ આરામાં તે નંદભદ્રગિરિના નામથી ઓળખાશે.’ આ રીતે શ્રી ગિરનારજુ સંબંધી હકીકત જાણી કુમારપાળ ભૂપાળ અતિ હર્ષિત થયા અને ગુરુ મહારાજને પૂછ્યું કે- “હે સ્વામિન્ ! આ વજરલ્નમયી પ્રતિમા કોણે અને કચારે ભરાવી ?”

ગુરુમહારાજે કહ્યું કે- “આ ભરતક્ષેપને વિષે ગત ચોવીશીમાં ત્રીજા શ્રી સાગર તીર્થકરના સમયે ઉજ્જયિની નગરીમાં નરવાહન નામે રાજ રાજ્ય કરતો હતો. તેના ઉદ્ઘાનમાં શ્રી સાગર તીર્થકર એક વખતે સમવસર્યા. તે વધામણી સાંભળી નરવાહન રાજ સકળજનસહિત વંદન કરવા નીકળ્યા, અને યથાવિદ્ય વંદન કરીને યોગ્ય રથાનકે જેસી તીર્થકર મહારાજની અમૃતમય દેશના તોણે સાંભળી. પછી વિનયસહિત બે હસ્ત જોડી પૂછવા લાગ્યા કે- “હે સ્વામી ! હું કયારે કેવળજ્ઞાન પામીશા ?” ત્યારે શ્રી સાગરજિનેશ્વર બોલ્યા કે- “હે નરવાહન રાજ ! તમે આવતી ચોવીશીમાં શ્રી નેમિનાય પ્રભુના સમયે કેવળી થશો.”

નરવાહન નૃપતિએ વૈરાગ્યમય શ્રી જિનવાણી

સાંભળીને તરતજ સંસારની અસારતા સમજુ દીક્ષા અંગીકાર કરી અને વિશુદ્ધપણે ચારિત્ર પાળી કાળધર્મ પામી બ્રહ્મદેવલોકને વિષે દશ સાગરોપમના આયુષ્યવાળા ઈંડ થયા. ત્યાં ઉત્પન્ન થતાં જ આ સુરપદવી શાથી પ્રાક્ત થઇ ? એ અવધિજ્ઞાનવડે જાણીને શ્રી જિનેશ્વર ભગવંતની ભક્તિ કરવા અને પોતાના આત્માનો પણ ઉદ્ધાર કરવા બાવીશમા તીર્થકર શ્રી નેમિનાથ પ્રભુની વજરણની પ્રતિમા ભરાવી પોતાના દેરાસરમાં પદ્ધરાવી. પછી બહુ કાળપર્યત તેની પર્યુપાસના-સેવા કરી.

ભવને અંતે પોતાનું અથ્ય આયુષ્ય બાકી રહ્યું છે એમ સમજુને તે ઈંદ્રે આ વજમય નેમિનાથની પ્રતિમા જ્યાં એ પ્રભુના દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ એ ગ્રણે કલ્યાણક થવાના હતા એવાં પવિત્ર ગિરિ શ્રી દૈવતાચળમાં પદ્ધરાવવાનો નિશ્ચય કર્યો. સ્વર્ગમાંથી પ્રતિમા લઈને તે ઈંડ ગિરણારજી પર્વત ઉપર આવ્યા અને વજવડે તેને ખોદીને ભૂમિમાં ઝપાનું મનોહર મંદિર બનાવ્યું અને તેને ગ્રણ ગભારા કર્યા, જેમાં રણના, મહિના અને સુવર્ણના એ રીતે ગ્રણ બિંબની સ્થાપના કરી અને આગાળ સુવર્ણનું પબાસણ કરીને તેની ઉપર વજમયી નેમિનાથની પ્રતિમાની સ્થાપના કરી.

-: શાશ્વત ગિરિ મહિમા :-

તે દંદ આચુ સંપૂર્ણ કરી ત્યાંથી સંસાર પરિભ્રમાણ  
કર્યા બાદ શ્રી નેમિનાથ તીર્થકરના સમયે મહાપલિ દેશને  
વિષે ક્ષિતિસાર નામે નગરમાં પુન્યસાર નામે રાજા થયો,  
જેના પુન્યના આકર્ષણથી શ્રી નેમિનાથ ભગવાન ત્યાં  
આવીને સમવસર્યા. તે વધામણી સાંભળી પુન્યસાર રાજ  
તરત જ પ્રભુને વંદન કરવા આવ્યા. પ્રભુની દેશના સાંભળી  
મિથ્યાત્વ પરિણિતિનો ત્યાગ કરીને તે શુદ્ધ શ્રાવક થયા  
અને પ્રભુ પાસેથી પોતાનો પૂર્વભવ સાંભળી ગટગિરનારે  
જઇને બહુ પ્રકારે પ્રભુભક્તિ કરી. પાછો પોતાના નગરમાં  
આવી સંસારને અસાર સમજુ ઘેરાગ્યવાસિત ચિત્ત થવાથી  
પોતાના પુઅંને રાજગાડી ઉપર બેસાડી નેમિનાથ પ્રભુ પાસે  
દીક્ષા ગ્રહણ કરી. પછી અનેક પ્રકારના તપ તપી અષ્ટ  
કર્માને ખપાવીને મુક્તિપદ પ્રાપ્ત કર્યું. આ રીતે બાવીશમા  
તીર્થકર શ્રી નેમિનાથ પ્રભુના ત્રણે કલ્યાણક અત્રે થવાથી  
આ ગિરિ અને આ બિંબ ત્રણે લોકમાં પૂજનિક છે.  
પુન્યસારના મોક્ષ ગયા બાદ અનુકૂમે આ ગિરનારજુ તીર્થ  
ઉપર એક લેપમય બિંબની સ્થાપના થઇ હતી.”

શ્રી હેમસૂરિ મહારાજે આગામ વર્ણન કરતાં જણાવ્યું  
કે- “શ્રી નેમિનાથ ભગવાનના નિર્વાણ પછી નવ સો વર્પથી

- : શાશ્વત ગિરિ મહિમા :-

કાંઈક અધિક વર્ષ વીત્યા બાદ શ્રી કાશમીર દેશનો રત્ન નામનો શ્રાવક પવિત્ર તીર્થ શ્રી ગિરનારની ચાચા કરવા આવ્યો. દર્શન કર્યા બાદ પ્રભુપૂજા કરવા માટે રત્નશ્રાવકે વિધિવત સ્નાન કર્યું અને પછી ઉત્તમ પ્રકારની સામગ્રી લઇને પ્રભુની જળપૂજા કરવામાં તલ્લીન બની જળ-કળશ ભરીને પ્રભુનું પ્રક્ષાલન કરવું શરૂ કર્યું. તે જળની ધારા બિંબ ઉપર પડતાં જ તે લેપમય બિંબ ગળી ગયું. આ જોતાં તે રત્ન શ્રાવક મનમાં ધણો જ ખેદ પામ્યો અને આ રીતની પ્રભુની મહાન આશાતના થવાથી તે શ્રાવક ત્યાં જ ચાર આહારનો ત્યાગ કરીને બેઠો. એ રીતે તેને સાઠ દિવસના ઉપવાસ થયા. તે તપશ્ચર્યાના આકર્ષણથી શ્રી અંબિકાદેવી પ્રસંગ થઇને ત્યાં આવ્યા અને તે રત્નશ્રાવકને કહ્યું કે :- “હે વત્સ ! ખેદ કરવાનું કાંઈ કારણ નથી. આ લેપમય બિંબ ગળી ગયું તે સ્થાને બ્રહ્મેદ્રના કરેલા ભૂમિયૈત્યમાં સુવર્ણના પબાસણ ઉપર પદ્ધરાવેલી વજમયી પ્રતિમા છે તે લાવીને અહિં પદ્ધરાવ.” પછી તે રત્નશ્રાવકે દેવીવચનાનુસાર આ વજમયી પ્રતિમા ત્યાંથી લાવીને અહિં પદ્ધરાવી છે જે મ્રણ જગતમાં સર્વને પૂજનિક છે. અન્ય શાસ્ત્રમાં પણ કહેલ છે કે- “વામન અવતારને વિષે વિષ્ણુએ બલિરાજાને બાંધવા સારુ

શ્રી રૈવતાચળ ઉપર આવીને શ્રી નેમિનાથની આરાધના કરી હતી.”

આ પ્રમાણે શ્રી ગિરનારજુ તીર્થનું અપૂર્વ માહાત્મ્ય શ્રી હેમસૂરિ પાસેથી સાંભળીને કુમારપાળ રાજાના હૃદયમાં હર્ષનો પાર રહ્યો નહિ અને ઉલ્લાસમાં આવીને બહુ ભક્તિ ભાવપૂર્વક પ્રભુસેવા કરી પોતાનો જન્મ ફૂલાર્થ કર્યો. પછી તીર્થમાળ પહેરવાનો અવસર આવ્યો, તે વખતે રકમની ઉછામણી બોલાતાં સવાકરોડની બોલીથી તે આદેશ પણ શેઠ જગડુશાહે લઇને પોતાની માતાના ગળામાં ઇંદ્રમાળ પહેરાવી તેને એ અતિ ઉત્તમ લ્હાવો લેવરાવ્યો.

શેઠ જગડુશાહે સવા કરોડની બોલીથી જે આદેશ લીધો હતો તેનાં દામ ચૂકવવા માટે પ્રથમની માફક સવા કરોડનું મૂલ્યવંત એક રત્ન કુમારપાળ ભૂપાળની આગળ વિનયપૂર્વક રજુ કર્યું. તે વખતે આશ્ર્ય પામીને રાજાજુએ પૂછ્યું કે- “શેઠજી ! આવાં અમૂલ્ય રત્નો આપને કયાંથી મળ્યાં છે ?” તેના જવાબમાં જગડુશાહે નિવેદન કર્યું કે- “શ્રી મહુવા નગરીમાં હંસરાજ મંત્રી નામે મહારા પૂજય પિતાશ્રીને પુન્યયોગે આવાં પાંચ રત્નો પ્રાક્ત થયાં હતાં, જેમાંના પ્રણ રત્નો સંઘભક્તિ કરવા નિમિતે તીર્થયાત્રામાં

-ઃ શાશ્વત ગિરિ મહિમા :-

ખર્ચવા તેમનો ખાસ દરાદો હતો અને એ માટે હુદયમાં તેમને ઉંચી ભાવના પણ હતી; પરંતુ કાળની વિષમ ગતિ હોવાથી એ પ્રકારની તેમની મનની દરદ્ધા મનમાં જ રહી ગઈ. એટલે એ કાર્ય કરવાની અભિલાષા સફળ થયા પહેલાં એમનું સ્વર્ગગમન થવાથી એ પાંચ રલ્નો મહારી પાસે આવ્યા. મહારા સ્વર્ગરસ્થ પૂજય પિતાશ્રીની દરદ્ધાનુસાર તેમાંનાં પ્રણ રલ્નો પૈકી બે રલ્નો તો શ્રી શાંતંજ્ય તીર્થ અને શ્રી ગિરનારજી તીર્થમાં આ રીતે વપરાણા છે અને એક રલ્ન દેવપતન (પ્રભાસપાટણ) વાપરવાનું છે, બાકીના બે મહારા નિર્વાહ નિમિત્તે રાખવાનું તેઓશ્રી ફરમાવી ગયેલા છે.”

શેઠ જગડુશાહે કુમારપાળ મહારાજાએ કરેલી તીર્થયાા અને સંઘભક્તિ જોઇને હર્ષપૂર્વક વિનંતિ કરી કે- “કૃપાળુ રાજાજી ! આ તે બજે મૂલ્યવંત રલ્નો હું આપની પાસે ભેટ ધરું છું, તો આપશ્રી તેનો જરૂર સ્વીકાર કરશો.” આ પ્રકારનો પ્રેમભાવ જોઇ કુમારપાળ બોલ્યા કે- “જગતમાં જગડુશાહને ખરેખર દાન્યવાદ ધટે છે કે જેણે પોતાના પિતાશ્રીની જે દરદ્ધા હતી તે ભાવપૂર્વક પૂરી પાડી, તીર્થતુલ્ય પોતાની માતુશ્રીને ઉત્તમ છ્હાવો લેવરાવ્યો અને મૂલ્યવંત પ્રણ રલ્નોનો સદ્દબ્યય કરી હજુ નિર્વાહનિમિતના બે રલ્નો

-: શાશ્વત તિંકિ મહિમા :-

પણ પ્રેમપૂર્વક મને ભેટ દારી દે છે.” આ રીતે કહીને રાજાજુએ જગડુશાહને પોતાની પાસે બેસાડી રલ્નો લેવા માટે ના પાડી; પરંતુ જગડુશાહનું દિલ દુખાતું જોઈને તે રલનો સ્વીકાર કરી છેવટે રાજાજુએ અટી કરોડ રૂપિયા આપી જગડુશાહનો બહુ રીતે સત્કાર કર્યો.

આ રીતે કુમારપાળ રાજ શ્રી શાશ્વત ય અને શ્રી ગિરનારજુ તીર્થની સંદ્ય સહિત યાત્રા કરી સંપૂર્ણ લાભ લઈને અનુક્રમે શ્રી પાટણપુરીમાં પાછા પદ્ધાર્ય. તે વખતે બહોંતેર સામંતાદિની સામૈયામાં હાજરી હતી. એ રીતે બહુ જ ધામ ધુમ રૂને હર્ષપૂર્વક નગરપ્રવેશ કર્યો. પછી સુપુન્યે શાશ્વતી અહૃદાઇના શુભ દિવસોનો સુયોગ પ્રાપ્ત થવાથી દેવતાઓ જેમ નંદીશ્વરદ્વિપમાં જઇ અણાહનિકા મહોત્સવપૂર્વક શ્રી જિનભક્તિ કરે છે તે રીતે બહુ જ મહોત્સવપૂર્વક કુમારપાળ મહારાજાએ પાટણપુરીમાં અહૃદાઇ મહોત્સવ શરૂ કરાવ્યો અને તન-મન-ધનથી ઉત્તમ પ્રકારે છાવો લઈને આત્મોન્નતિની સાથે શાસનોન્નતિ કરી. રાસકર્તા કવિ અધિભદાસજી કહે છે કે :-

સકળ કામ કુમારે કર્યા, રાખ્યું જગમાં નામ;

નિત્ય સેવા કરે ગુરતણી, મુખ બોલે ગુણગ્રામ.

એક સમયે શ્રી હેમસૂરિ મહારાજ શ્રી વીરપ્રભુનું ચાચિત્ર વાંચતા હતા અને કુમારપાળ ભૂપાળ આદિ સભા એક ચિતે મધુરી દેશનાનું પાન કરતી હતી, જેમાં જગતપ્રભુ શ્રી મહાવીર ભગવાનની પ્રતિમાનો સંબંધ આવતાં અભયકુમારે વિનયવડે તે સમયે પ્રભુ શ્રી મહાવીરસ્વામીને પૂછેલું કે:- “હે કૃપાળુનાથ ! આ જીવિતસ્વામીની પ્રતિમા કેટલા કાળ સુધી પૂજાશે ? અને છેવટે તે પ્રતિમા ક્યાં જશે ?” આ પ્રશ્ના ઉંતરમાં અનંતજ્ઞાનના ધણી પ્રભુ શ્રી વીર ભગવાન બોલ્યા કે- “આગળ એક કુમારપાળ નામે રાજ થશે જે વિટાભયપાટણથી આ પ્રતિમા અણહિલપુરપાટણમાં લાવી પ્રિકાળપૂજા કરશે.” આ રીતે સભાસમક્ષ શ્રી વીરચાચિત્ર દ્વારા શ્રી હેમસૂરિ પાસેથી આવી અદ્ભુત હકીકત સાંભળી કુમારપાળ રાજ હૃદયમાં બહુ જ હર્ષિત થધને બોલ્યા કે- “અહો ! અહો ! મહારં પુન્ય પ્રબળ દીસે છે કે હું શ્રી વીરપ્રભુની રસનાએ ચડયો, તેમજ હું ભાગ્યશાળી લેખાઉં કે શ્રી વીરભગવાને દેવ, મનુષ્ય અને તિર્યાચની મોટી સભામાં અભયકુમાર મંત્રી પાસે મહારં નામ ઉચ્ચાર્યું.” પછી હર્ઘના આવેશમાં કુમારપાળ ભૂપાળ બોલ્યા કે :-

- : શાશ્વત ગિરિ મહિમા :-

સફળ થયો મહારો અવતાર, વીરે કીદી મહારી સાર;  
રસનાં ચડીયું મુજ નામ, તો સહી સિદ્ધાં મહારાં કામ.

ત્યારબાદ ગુરુમહારાજને 'એ પ્રતિમા ક્યાં છે ?'

એ હકીકત પૂછતાં શ્રી વીતભયનગરમાં એ પ્રતિમા જણાવતાં  
કુમારપાળ રાજાએ જલ્દી પોતાના સેવકોને ત્યાં મોકદ્યા  
અને આડંબરસહિત વિદ્યિપૂર્વક તે પ્રતિમા પાટણપુરીમાં  
લાવી, પોતાના ખર્ચે રત્નનું દેરાસર કરાવી મહોત્સવપૂર્વક  
તે જુવિતસ્વામીની પ્રતિમા તેમાં પદ્ધરાવી. પછી હંમેશા  
અષ્ટદ્રવ્યની સામગ્રીસહિત ભાવપૂર્વક તે ભક્તિ કરવા  
લાગ્યા અને પ્રભુની ભેટથી-પ્રભુના દર્શનથી હૃદયમાં  
આહુલાદનો પાર રહ્યો નાહિ. એટલે કે જેમ કોઇ દર્દિનીને  
ચિંતામણિ રત્ન મળતાં, જેમ કોઇ બૂડતાં માણસને વહાણ  
મળી જતાં, જેમ ગરમીથી આકુલબ્યાકુળ થનારને અમૃતનો  
કુંડ મળતાં અને જેમ ભૂખ્યાને ખીર-ખાંડના મિષ્ટ બોજન  
મળતાં તેના આનંદનો પાર રહે નાહિ તેમ એ પ્રતિમાને  
બોઇને કુમારપાળ રાજાના હૃદયમાં આનંદ આનંદ થઈ રહ્યો.



-ઃ શાખત ગારિ મહિમા :-

૫૦

## પૂજ્ય આચાર્યશીના પ્રકાશિત થયેલા પ્રકાશનો

| ક્રમ | પુસ્તક                                      | રૂ. પૈસા           |
|------|---------------------------------------------|--------------------|
| ૧    | જીવવિચાર (બીજી આવૃત્તિ)                     | પ્રશ્નોત્તરી ૩૦-૦૦ |
| ૨    | દંડક ★                                      | પ્રશ્નોત્તરી ૪-૦૦  |
| ૩    | નવતત્ત્વ (બીજી આવૃત્તિ)                     | પ્રશ્નોત્તરી ૪૦-૦૦ |
| ૪    | કર્મગ્રંથ-૧ ★                               | પ્રશ્નોત્તરી ૬-૦૦  |
| ૫    | કર્મગ્રંથ-૨ ★                               | પ્રશ્નોત્તરી ૭-૦૦  |
| ૬    | કર્મગ્રંથ-૩ (બીજી આવૃત્તિ)                  | પ્રશ્નોત્તરી ૩૬-૦૦ |
| ૭    | કર્મગ્રંથ સત્તાપ્રકારણ ★                    | પ્રશ્નોત્તરી ૧૦-૦૦ |
| ૮    | ઉદ્ય સ્વામિત્વ ★                            | પ્રશ્નોત્તરી ૧૫-૦૦ |
| ૯    | કર્મગ્રંથ-૪ ભાગ-૧ ★                         | પ્રશ્નોત્તરી ૪૦-૦૦ |
| ૧૦   | કર્મગ્રંથ-૪ ભાગ-૨ ★                         | પ્રશ્નોત્તરી ૧૫-૦૦ |
| ૧૧   | કર્મગ્રંથ-૫ ભાગ-૧ ★                         | પ્રશ્નોત્તરી ૧૫-૦૦ |
| ૧૨   | કર્મગ્રંથ-૫ ભાગ-૨ ★                         | પ્રશ્નોત્તરી ૧૫-૦૦ |
| ૧૩   | લધુ સંગ્રહકુણી ★                            | પ્રશ્નોત્તરી ૬-૦૦  |
| ૧૪   | જીવવિચાર-દંડક-લધુ સંગ્રહકુણી (બીજી આવૃત્તિ) | પ્રશ્નોત્તરી ૪૦-૦૦ |
| ૧૫   | કર્મગ્રંથ-૫ ભાગ-૩ ★                         | પ્રશ્નોત્તરી ૪૫-૦૦ |
| ૧૬   | કર્મગ્રંથ-૫ ભાગ-૪ ★                         | પ્રશ્નોત્તરી ૧૮-૦૦ |
| ૧૭   | કર્મગ્રંથ-૧ તથા ૨ (બીજી આવૃત્તિ)            | પ્રશ્નોત્તરી ૩૮-૦૦ |
| ૧૮   | કર્મગ્રંથ-૬ ભાગ-૧ ★                         | પ્રશ્નોત્તરી ૨૧-૦૦ |
| ૧૯   | કર્મગ્રંથ-૬ ભાગ-૨ ★                         | પ્રશ્નોત્તરી ૪૦-૦૦ |
| ૨૦   | કર્મગ્રંથ-૬ ભાગ-૩ ★                         | પ્રશ્નોત્તરી ૩૧-૦૦ |
| ૨૧   | કર્મગ્રંથ-૬ ભાગ-૪ ★                         | પ્રશ્નોત્તરી ૩૫-૦૦ |
| ૨૨   | કર્મગ્રંથ-૬ ભાગ-૫ ★                         | પ્રશ્નોત્તરી ૩૮-૦૦ |

| ક્રમ | પુસ્તક                                        |              | રૂ. પૈસા |
|------|-----------------------------------------------|--------------|----------|
| ૨૩   | કર્મગ્રંથ-૬ ભાગ-૬ ★                           | પ્રશ્નોત્તરી | ૩૫-૦૦    |
| ૨૪   | કર્મગ્રંથ-૬ ભાગ ૭+૮ ★                         | પ્રશ્નોત્તરી | ૨૪-૦૦    |
| ૨૫   | કર્મગ્રંથ-૪ ભાગ ૧+૨                           | પ્રશ્નોત્તરી | ૭૦-૦૦    |
| ૨૬   | કર્મગ્રંથ-૫ ભાગ ૩+૪                           | પ્રશ્નોત્તરી | ૬૫-૦૦    |
| ૨૭   | કર્મગ્રંથ-૫ ભાગ ૧+૨                           | પ્રશ્નોત્તરી | ૭૫-૦૦    |
| ૧.   | જીવવિચાર (બીજી આવૃત્તિ)                       | વિવેચન       | ૧૬-૦૦    |
| ૨.   | નવતત્ત્વ (બીજી આવૃત્તિ)                       | વિવેચન       | ૨૦-૦૦    |
| ૩.   | કર્મગ્રંથ-૧                                   | વિવેચન       | ૧૫-૦૦    |
| ૪.   | ચૌદ ગુણસ્થાનક                                 | વિવેચન       | ૧૬-૦૦    |
| ૫.   | શ્રી જ્ઞાનાચાર★                               |              | ૧૬-૦૦    |
| ૬.   | શ્રી જંબૂસ્વામી ચરિત્ર ★                      |              | ૨૧-૦૦    |
| ૭.   | દુર્ઘાન સવરૂપ દર્શન (બીજી આવૃત્તિ)            |              | ૨૬-૦૦    |
| ૮.   | શ્રી જિનપૂજા                                  |              | ૪-૦૦     |
| ૯.   | શ્રી શરૂંજ્ય માહાત્મ્ય-સર્ગ-૧                 |              | ૧૦-૦૦    |
| ૧૦.  | આંતરશત્રુઓ ★                                  |              | ૧૪-૦૦    |
| ૧૧   | ધર્મને ભજો આશાતના તજો ★                       |              | ૭-૦૦     |
| ૧૨   | અનુભવવાક્ષી સૂરિયામની ભાગ-૧                   |              | ૩૮-૦૦    |
| ૧૩   | અનુભવવાક્ષી સૂરિયામની ભાગ-૨                   |              | ૩૮-૦૦    |
| ૧૪   | કલિકણના કોઈનુર (જૈનેતરની દ્રષ્ટિઓ)            |              | ૧૪-૦૦    |
| ૧૫   | કર્મગ્રંથ-૬ વિવેચન ભાગ-૧                      |              | ૪૮-૦૦    |
| ૧૬   | બાસઠ માર્ગશાને વિષે નામકર્મ સંવેદ વર્ણન ભાગ-૧ |              | ૫૦-૦૦    |
| ૧૭   | બાસઠ માર્ગશાને વિષે નામકર્મ સંવેદ વર્ણન ભાગ-૨ |              | ૫૦-૦૦    |
| ૧૮   | શ્રી અરિહંત પરમાત્માનું સ્વરૂપ                |              | ૧૨-૦૦    |
| ૧૯   | કર્મગ્રંથ-૨                                   | વિવેચન       | ૨૦-૦૦    |
| ૨૦   | કર્મગ્રંથ-૩                                   | વિવેચન       | ૧૮-૦૦    |

| ક્રમ | પુસ્તક                                                                            | વિવેચન | રૂ. પૈસા |
|------|-----------------------------------------------------------------------------------|--------|----------|
| ૨૧   | કર્મગ્રંથ-૪                                                                       | વિવેચન | ૩૨-૦૦    |
| ૨૨   | સૂરિરામની વાણી જ્ઞાન રત્નોની ખાડી-ઉપદેશમૃત ★                                      |        | ૩૮-૦૦    |
| ૨૩   | સૂરિરામની વાણી જ્ઞાન રત્નોની ખાડી-ઉપદેશમૃત પ્રત-૧                                 |        | --       |
| ૨૪   | સૂરિરામની વાણી જ્ઞાન રત્નોની ખાડી-તીર્થયાત્રાનો<br>વાસ્તવિક હેતુ-ભાગ-૧ પ્રત-૨     |        | --       |
| ૨૫   | સૂરિરામની વાણી જ્ઞાન રત્નોની ખાડી-તીર્થયાત્રાનો<br>વાસ્તવિક હેતુ-ભાગ-૧ ★          |        | ૪૫-૦૦    |
| ૨૬   | સૂરિરામની વાણી જ્ઞાન રત્નોની ખાડી-તીર્થયાત્રાનો<br>વાસ્તવિક હેતુ-ભાગ-૨-પ્રત-૩     |        | --       |
| ૨૭   | સૂરિરામની વાણી જ્ઞાન રત્નોની ખાડી-પુસ્તક-૩<br>તીર્થયાત્રાનો વાસ્તવિક હેતુ-ભાગ-૨★  |        | ૪૨-૦૦    |
| ૨૮   | સૂરિરામની વાણી જ્ઞાન રત્નોની ખાડી-શ્રી<br>આચારાંગ સૂત્રના વ્યાખ્યાનો ભાગ-૧-પ્રત-૪ |        | --       |
| ૨૯   | સૂરિરામની વાણી જ્ઞાન રત્નોની ખાડી-શ્રી<br>આચારાંગ સૂત્રના વ્યાખ્યાનો ભાગ-૨-પ્રત-૫ |        | --       |
| ૩૦   | કર્મગ્રંથ-૧ વિવેચન (નવી આવૃત્તિ)                                                  |        | ૫૦-૦૦    |
| ૩૧   | સૂરિરામની વાણી જ્ઞાનરત્નોની ખાડી<br>શ્રી આચારાંગ સૂત્રના વ્યાખ્યાનો ભાગ-૩ પ્રત-૬  |        |          |
| ૩૨   | શ્રી જિનનું દર્શન-વંદન-પૂજન                                                       |        | ૩૦-૦૦    |
| ૩૩   | શ્રી કલ્પસૂત્રના વ્યાખ્યાનો પ્રત-૭                                                |        | --       |
| ૩૪   | શ્રી પર્યુપણાએન્ટિકના વ્યાખ્યાનો પ્રત-૮                                           |        | --       |
| ૩૫   | શ્રી કલ્પસૂત્રના વ્યાખ્યાનો (હિન્દી લિપિ) પ્રત-૯                                  |        | --       |
| ૩૬   | શ્રી પર્યુપણાએન્ટિકના વ્યાખ્યાનો (હિન્દી લિપિ) પ્રત-૧૦                            |        | --       |
| ૩૭   | કર્મગ્રંથ-૫ વિવેચન                                                                |        | ૫૫-૦૦    |
| ૩૮   | જીવિતાર વિવેચન (નવી આવૃત્તિ) ★                                                    |        | ૪૦-૦૦    |

| ક્રમ | પુસ્તક                                   | રૂ. પૈસા |
|------|------------------------------------------|----------|
| ૩૯.  | નવતત્ત્વ વિવેચન (નવી આવૃત્તિ)            | ૧૫૦-૦૦   |
| ૪૦.  | ચૌદ ગુજરાતીસ્થાનક ભાગ-૧ (નવી આવૃત્તિ)    | ૬૦-૦૦    |
| ૪૧.  | ચૌદ ગુજરાતીસ્થાનક ભાગ-૨ (નવી આવૃત્તિ)    | ૮૫-૦૦    |
| ૪૨.  | ચૌદ ગુજરાતીસ્થાનક ભાગ-૩ (નવી આવૃત્તિ)    | ૬૦-૦૦    |
| ૪૩.  | દંડક વિવેચન                              | ૭૫-૦૦    |
| ૪૪.  | જીવતત્ત્વ-અજીવ તત્ત્વ વિવેચન             | ૩૫-૦૦    |
| ૪૫.  | નમસ્કાર મહામંત્રનું સ્વરૂપ               | ૨૦-૦૦    |
| ૪૬.  | જીવવિચાર વિવેચન                          | ૮૦-૦૦    |
| ૪૭.  | શ્રી પંચપરમેષ્ઠિ નમસ્કારનો પ્રભાવ        | ૨૦-૦૦    |
| ૪૮.  | પુષ્યતત્ત્વનું સ્વરૂપ                    | ૩૦-૦૦    |
| ૪૯.  | શ્રી અષ્ટમકારી પૂજાનું વર્ણન             | ૪૦-૦૦    |
| ૫૦.  | ૭ આવશ્યકના રહસ્યો                        | ૩૦-૦૦    |
| ૫૧.  | ૫૬૩ જીવભેદને વિશે જ્ઞાનદ્વારનું વર્ણન    | ૨૦-૦૦    |
| ૫૨.  | અદાર દોષોથી રહિત શ્રી અરિહંત પરમાત્મા    | ૩૫-૦૦    |
| ૫૩.  | આવશ્યક કિયાના સૂત્રોનાં રહસ્યોનું વર્ણન  | ૩૫-૦૦    |
| ૫૪.  | મુહૂરત (મુખવલ્લિકા)ના પચાસ બોલોનું વર્ણન | ૮૦-૦૦    |
| ૫૫.  | કર્મબંધ વિવેચન વર્ણન                     | ૨૦-૦૦    |
| ૫૬.  | પાપતત્ત્વ                                | ૫૫-૦૦    |
| ૫૭.  | શાશ્વત ગિરિ મહિમા                        | ૧૨-૦૦    |

★ આ નિશાનીવાળા પુસ્તકો અતખ્ય છે.



પદાર્થ દર્શન ટ્રસ્ટ  
અમદાવાદ